



# THE BARODA CITY CO-OPERATIVE BANK LTD

## ધી બરોડા સીટી કો-ઓપરેટીવ બેંક લી.

# 97


## TH ANNUAL REPORT 2023-24

વાર્ષિક અહેવાલ ૨૦૨૩-૨૪

Everything About Your **Bank**

Now..... at your **Fingertips.**

- EXCLUSIVE • SECURE • INTERACTIVE



WITH

“The Baroda City Co-Operative Bank App”



- BALANCE INQUIRY
- LAST 5 IMPS TRANSACTION
- MINI STATEMENT
- GREEN PIN

Regd Office: Sanstha Vasahat Raopura, Vadodara-390001  
સંસ્થા વસાહત, રાવપુરા, વડોદરા-૩૯૦૦૦૧

Email : servicedesk@bccbank.coop

Website : www.bccbank.coop

Scan Me





# ધી બરોડા સીટી કો-ઓપરેટીવ બેંક લી.

રજીસ્ટર્ડ ઓફીસ : સંસ્થા વસાહત, રાવપુરા, વડોદરા-૩૯૦ ૦૦૧.

## KNOW YOUR BANK

અનુ. નં.	શાખા નું નામ તથા સરનામું	કુલ થાપણો	કુલ ધિરાણ	નફો / નુકશાન
૧	<b>હેડ ઓફીસ:</b> RBI LICENCE NO : DBOD.UBD.GJ.321 P RBI LICENCE DATE : 05.11.1982 MICR CODE : 390156006 સંસ્થા વસાહત, રાવપુરા, વડોદરા - ૩૯૦ ૦૦૧. ફોન નંબર : ૨૪૨૮૫૧૪, ૨૪૩૮૩૫૦, ૨૪૨૮૯૭૪, ૨૪૩૮૪૨૨ મોબાઈલ : ૭૪૮૬૦ ૧૬૨૦૧ / ૭૪૮૬૦ ૧૬૨૦૨ ઈ-મેઈલ : HOBANCH@BCCBANK.COOP / LOAN@BCCBANK.COOP સેઈફ ડીપોઝીટ વોલ્ટ સાથે	1,90,70,85,289.04	40,08,82,786.61	11,52,336.64
૨	<b>વાડી શાખા:</b> RBI LICENCE NO : ACD.BL.23 RBI LICENCE DATE : 14.08.1967 MICR CODE : 390156003 લક્કડપીઠા રોડ, પથ્થરગેટ, વડોદરા - ૩૯૦ ૦૦૧. ફોન નંબર : ૨૪૨૯૩૩૩૪, મોબાઈલ : ૭૪૮૬૦ ૧૬૨૦૩ ઈ-મેઈલ : WADI@BCCBANK.COOP સેઈફ ડીપોઝીટ વોલ્ટ સાથે	15,36,16,293.92	18,08,26,186.87	53,60,933.97
૩	<b>ફતેહગંજ શાખા:</b> RBI LICENCE NO : ACD.BL.24 RBI LICENCE DATE : 14.08.1967 MICR CODE : 390156004 ચર્ચ સામે, ફતેહગંજ મેઈન રોડ, વડોદરા - ૩૯૦ ૦૦૨. ફોન નંબર : ૨૭૯૧૩૬૪, મોબાઈલ : ૭૪૮૬૦ ૧૬૨૦૪ ઈ-મેઈલ : FATEHGUNJ@BCCBANK.COOP	9,52,25,519.98	12,12,96,811.23	5,75,342.66
૪	<b>કારેલીબાગ શાખા:</b> RBI LICENCE NO : UBD.BL.1716 RBI LICENCE DATE : 03.01.1985 MICR CODE : 390156005 સરદાર છાત્રાલય સામે, આર્યકન્યા વિદ્યાલય રોડ, કારેલીબાગ, વડોદરા - ૩૯૦ ૦૧૮. ફોન નંબર : ૨૪૬૪૬૧૭, મોબાઈલ : ૭૪૮૬૦ ૧૬૨૦૫ ઈ-મેઈલ : KARELIBAUG@BCCBANK.COOP સેઈફ ડીપોઝીટ વોલ્ટ સાથે	34,89,63,806.55	26,58,60,128.05	79,00,296.77
૫	<b>ગોરવા શાખા:</b> RBI LICENCE NO : UBD.BL.2138 RBI LICENCE DATE : 29.03.1990 MICR CODE : 390156007 સનસાઈન કોમ્પ્લેક્સ, પહેલા માળે, ગોરવા-રીફાઈનરી રોડ, વડોદરા - ૩૯૦ ૦૧૬. ફોન નંબર : ૨૨૮૦૩૪૮, મોબાઈલ : ૭૪૮૬૦ ૧૬૨૦૬ ઈ-મેઈલ : GORWA@BCCBANK.COOP સેઈફ ડીપોઝીટ વોલ્ટ સાથે	22,99,78,349.75	12,40,84,630.79	32,03,668.69
૬	<b>ગોત્રી શાખા:</b> RBI LICENCE NO : UBD.AH.2 RBI LICENCE DATE : 12.08.1992 MICR CODE : 390156009 તક્ષ કોમ્પ્લેક્સ, પહેલા માળે, ગોત્રી મેઈન રોડ, વડોદરા - ૩૯૦ ૦૨૧. ફોન નંબર : ૨૩૩૬૯૦૪, મોબાઈલ : ૭૪૮૬૦ ૧૬૨૦૭ ઈ-મેઈલ : GOTRI@BCCBANK.COOP સેઈફ ડીપોઝીટ વોલ્ટ સાથે	30,02,58,613.13	28,04,37,592.29	86,28,107.60
૭	<b>માંજલપુર શાખા:</b> RBI LICENCE NO : UBD.AH.149 RBI LICENCE DATE : 15.02.1995 MICR CODE : 390156010 એટ્રીયા-૨ કોમ્પ્લેક્સ, ૨૧, રાજેન્દ્ર સોસાયટી, શ્રેયસ સ્કુલ સામે, વડોદરા - ૩૯૦ ૦૧૧. ફોન નંબર : ૨૬૪૧૯૩૩, મોબાઈલ : ૭૪૮૬૦ ૧૬૨૦૮ ઈ-મેઈલ : MANJALPUR@BCCBANK.COOP સેઈફ ડીપોઝીટ વોલ્ટ સાથે	20,86,24,920.02	21,57,50,753.85	52,95,198.96
૮	<b>હરણી રોડ શાખા:</b> RBI LICENCE NO : UBD.AH.492 RBI LICENCE DATE : 18.11.1999 MICR CODE : 390156011 વૃંદાવન કોમ્પ્લેક્સ, ઈ-ટાવર, પહેલા માળે, હરણી રોડ, વડોદરા - ૩૯૦ ૦૦૬ ફોન નંબર : ૨૪૯૧૬૦૭, મોબાઈલ : ૭૪૮૬૦ ૧૬૨૦૯ ઈ-મેઈલ : HARNI@BCCBANK.COOP સેઈફ ડીપોઝીટ વોલ્ટ સાથે	12,09,83,007.24	12,51,85,501.44	34,33,359.69
	કુલ	3,36,47,35,799.63	1,71,43,24,391.13	3,55,49,244.98
	<b>IFSC CODE : HDFC0CTBCCB</b>	<b>GST NUMBER : 24AAAAT1465D1ZW</b>		
	<b>PAN NUMBER : AAAAT1465D</b>	<b>TAN NUMBER : BRDT00268C</b>		





# ધી બરોડા સીટી કો-ઓપરેટીવ બેંક લી.

હેડ ઓફીસ : સંસ્થા વસાહત, રાવપુરા, વડોદરા.

સ્થાપના : તા. ૧૧-૧૦-૧૯૨૭

નોંધણી નંબર : ૧૭૩૨૧

રીઝર્વ બેંક લાયસન્સ નંબર : ડીબીઓડી.યુબીડી.જીજે૩૨૧પી (તા.૦૫-૧૧-૧૯૮૨)

## વ્યવસ્થાપક મંડળ

પ્રમુખ	:	શ્રી હરેનભાઈ શંભુભાઈ પટેલ
ઉપ પ્રમુખ	:	CA શ્રી સમીરભાઈ રણછોડલાલ પરીખ (પ્રોફેશનલ ડાયરેક્ટર)
એમ.ડી./ મંત્રી	:	શ્રી ડા. વિવેકભાઈ નરેન્દ્રભાઈ પટેલ
સહમંત્રી	:	CA શ્રી કીરીટકુમાર રસીકભાઈ અમીન (પ્રોફેશનલ ડાયરેક્ટર)
વ્યવસ્થાપકો	:	શ્રી હર્ષદકુમાર રણછોડભાઈ પટેલ (પ્રોફેશનલ ડાયરેક્ટર)
	:	શ્રી કાન્તીભાઈ ડાહ્યાભાઈ પટેલ (પ્રોફેશનલ ડાયરેક્ટર)
	:	શ્રી ડા. રાશીપભાઈ ઉપેન્દ્રભાઈ પટેલ
	:	શ્રી મૌલીનભાઈ મુકુન્દભાઈ પટેલ
	:	શ્રીમતી હેમાક્ષીબેન શ્રેયસભાઈ પટેલ
	:	શ્રીમતી દિનાબેન હરેનભાઈ પટેલ
	:	શ્રી ડા. ઠાકોરભાઈ અંબાલાલ પરમાર

## બોર્ડ ઓફ મેનેજમેન્ટ

શ્રી સમીરભાઈ રણછોડલાલ પરીખ	ઈન્ટરનલ સભ્ય
શ્રી હરેનભાઈ શંભુભાઈ પટેલ	ઈન્ટરનલ સભ્ય
શ્રી વિશાલભાઈ રાજેન્દ્રભાઈ પટેલ	એક્સટરનલ સભ્ય
શ્રી સુભાષભાઈ નંદલાલ શાહ	એક્સટરનલ સભ્ય
શ્રી યોગેશભાઈ જશભાઈ પટેલ	એક્સટરનલ સભ્ય

## શ્રી સત્યેન એસ પટેલ (સી.ઈ.ઓ)

સર્ટીફાઈડ ઓડીટર :

રાજેશ એન. શાહ

ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ

આર. એન. શાહ એસોસિયેટસ - વડોદરા

પેનલ નં. ૦૯

કન્કરન્ટ ઓડીટર :

જીગ્નેશ ડી. પટણી

ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ

જીગ્નેશ પટણી એન્ડ એસોસિયેટસ - વડોદરા

મેમ્બરશીપ નં. ૧૬૭૨૨૬

## : બેન્કર્સ :

૧. સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા, વડોદરા.
૨. બેંક ઓફ બરોડા, વડોદરા
૩. યુકો બેંક, વડોદરા
૪. એચ.ડી.એફ.સી. બેંક, વડોદરા
૫. આઈ.ડી.બી.આઈ.બેંક, વડોદરા
૬. કોટક મહીન્દ્રા બેંક, વડોદરા
૭. ધી ગુજરાત સ્ટેટ કો.ઓપ. બેંક લિ. અમદાવાદ
૮. ધી બરોડા સેન્ટ્રલ કો.ઓપ. બેંક લિ. વડોદરા
૯. આઈ.સી.આઈ.સી.આઈ. બેંક લિ. વડોદરા
૧૦. બેંક ઓફ મહારાષ્ટ્ર, વડોદરા

## ધી બરોડા સીટી કો-ઓપરેટીવ બેંક લી. વડોદરા.

### પ્રમુખશ્રીનું નિવેદન

માનનિય સભાસદ ભાઈઓ-બહેનો,

બેંકની ૯૭ (સત્તાણું) મી વાર્ષિક સાધારણ સભામાં આપ સૌને આવકાર આપતા અને બેંકના હિસાબો, સરવૈયું, નફા તોટા અને વાર્ષિક અહેવાલ આપ સૌ સમક્ષ રજુ કરતાં હું આનંદ અને ગૌરવ અનુભવું છું.

તા.૩૧.૦૩.૨૦૨૪ ના રોજ આપણી બેંકે પોતાની સફળ સેવા પ્રવૃત્તિ તથા એક ધારી પ્રગતિના ૯૭ વર્ષ પુરા કરી ૯૮ (અઠાણું) માં વર્ષમાં પ્રવેશ કર્યો છે. બેંકનો પ્રત્યેક સભાસદ તથા શહેરનો પ્રત્યેક નાગરીક બેંક પ્રત્યે અનન્ય માન અને વિશ્વાસ ધરાવે છે તેથી આવા હરીફાઈના સમયમાં બેંક પોતાની પ્રગતિ કરી શકી છે.

આપણી બેંકે ગ્રાહકોનો વિશ્વાસ જાળવી રાખી બેંકના ગ્રાહક લક્ષી અભિગમ અને ખાતેદારોને અપાતી વિવિધ સેવાઓના કારણે બેંકની થાપણોમાં ગયા વર્ષની સરખામણીમાં ચાલુ વર્ષે વધારો થયો છે તેમજ ધીરાણમાં પણ વધારો થયો છે અને વર્ષ આખરે રૂ.૩૩૬ કરોડ ૪૭ લાખ ૩૫ હજારની થાપણો છે તથા રૂ.૧૭૧ કરોડ ૪૩ લાખ ૨૪ હજારનું ધીરાણ છે. આપના અમૂલ્ય વિશ્વાસ અને સહકારના પરિણામે આ હરીફાઈના સમયમાં પણ બેંક તેની અવિરત પ્રગતિ જાળવી રાખી છે.

રીઝર્વ બેંકના આદેશ મુજબ બેંકે ડીપોઝીટ ઈન્સ્યોરન્સ અને ક્રેડીટ ગેરંટી કોર્પોરેશન (ડી. આઈ. સી. જી. સી.) નું એડવાન્સ વીમા પ્રિમીયમની રકમ રૂ.૨૪,૩૨,૭૧૪.૯૦ અંકે રૂપિયા ચોવીસ લાખ બત્રીસ હજાર સાતસો ચૌદ અને નેવું પૈસા પુરા તા.૧૫.૦૪.૨૦૨૪ ના રોજ ડીપોઝીટની સલામતી માટે ચુકવેલ છે.

ચાલુ સાલે બેંકના વ્યાજના દરોમાં ઘણી વખત ફેરફાર થયેલ છે. પરંતુ આપણી બેંકે આવા ચડ ઉતર થયેલ સમયમાં પણ કામકાજ તથા નફાનું ધોરણ જાળવી રાખેલ છે. જે આપ સર્વેના તથા ખાતેદારોના સાથ અને સહકારથી શક્ય બનેલ છે.

બેંકે તેના મુખ્ય ઉદ્દેશ્ય અનુસાર જરૂરીયાત વાળા સભાસદોને ઝડપી અને સરળ ધીરાણ પુરુ પાડવાની નીતી અપનાવી છે. બેંક ધ્વારા રોજગારલક્ષી અને ઉત્પાદનમાં વધારો થાય તે હેતુને લક્ષમાં રાખી તેની ધીરાણ નીતી અમલમાં મુકી છે અને ધીરાણનો વ્યાપ વધારવા બેંકે વિવિધ ધીરાણ યોજના અમલમાં મુકી છે. બેંક ધ્વારા સોનાના દાગીના સામે હાલમાં ધીરાણ ૮.૭૫% (પોણા નવ) ટકાના વ્યાજે આપવામાં આવે છે. જેનો સભાસદ તરફથી સારો પ્રતિસાદ મળે છે.

**સભાસદો:** માર્ચ - ૨૦૨૩ આખરે સભાસદોની સંખ્યા ૨૨૭૬૨ ની હતી જેમાં વર્ષ દરમ્યાન વધારો / ઘટાડો થતાં માર્ચ - ૨૦૨૪ આખરે સભાસદોની સંખ્યા ૨૨૯૨૨ ની થઈ છે. નોમીનલ સભાસદોની સંખ્યા વર્ષ આખરે ૧૧૬ ની છે.

**શેર ભંડોળ:** માર્ચ - ૨૦૨૩ આખરે બેંકનું ભરપાઈ થયેલું શેર ભંડોળ રૂ.૪,૬૬,૯૪,૧૩૦.૦૦ નું હતું જેમાં વર્ષ દરમ્યાન વધારો / ઘટાડો થતા માર્ચ - ૨૦૨૪ આખરે ભરપાઈ થયેલું શેર ભંડોળ રૂ.૪,૯૦,૮૦,૬૬૦.૦૦ નું છે.

**ડિવિડન્ડ:** બેંકના બોર્ડ ઓફ ડીરેક્ટર્સ ચાલુ વર્ષે સભાસદોને દશ (૧૦%) ટકા મુજબ ડીવિડન્ડ આપવા ભલામણ કરેલ છે તે સ્વીકારી મંજૂર કરવા ભલામણ કરું છું.

**વ્યવસ્થાપક મંડળની સભાઓ:** વર્ષ દરમ્યાન વ્યવસ્થાપક મંડળની ૧૩ સભાઓ મળી હતી.

**વસુલાતના પગલાં:** વર્ષની શરૂઆતમાં ૯૦ દાવા બાકી હતા જેમાં વર્ષ દરમ્યાન - દાવા નવા દાખલ કર્યા તથા ૦૨ હુકમનામાની રકમ ચુકતે વસુલ આવી ગઈ છે. જેથી વર્ષ આખરે ૮૮ દાવા બાકી રહે છે. જેની વસુલાત માટેની કાર્યવાહી ચાલુ છે. દાવા તથા જપ્તીનો પ્રસંગ ના આવે તે માટે બાકીદારોએ તેમણે લીધેલ લોનના હપ્તા નીચમીત ભરી જવા વિનંતી

## ધી બરોડા સીટી કો-ઓપરેટીવ બેંક લી. વડોદરા.

છે. અમુક નબળા પડેલા ખાતાઓમાં વસુલાત માટે સભાસદો સામે ના છુટકે કડક પગલાં લેવાની વ્યવસ્થાપક મંડળને ફરજ પડી છે. જરૂરી જોગવાઈઓ તેમજ વસુલાતના સતત પ્રયત્નોથી બેંકનું નેટ એન.પી.એ. ૦.૦૦ (ઝીરો) ટકા રહ્યું છે.

### સેવાકીય પ્રવૃત્તિ:

(૧) લોકર વ્યવસ્થા: બેંકની હેડ ઓફીસ, વાડી, (લકકડ પીઠા રોડ), કારેલીબાગ (સરદાર છાત્રાલય સામે), ગોરવા, ગોત્રી, માંજલપુર તથા હરણી રોડ શાખાઓમાં લોકર વ્યવસ્થા છે. જેનો લાભ લેવા અને લેવડાવવા આપ સૌને વિનંતી છે.

રીઝર્વ બેંક ઓફ ઈન્ડીયાના સરક્યુલરની સુચના મુજબ જુના તમામ લોકર ધારકોને તા.૩૧.૧૨.૨૦૨૩ સુધીમાં નવેસરથી કરાર કરવાનો રહેશે. તા.૩૧.૧૨.૨૦૨૩ બાદ જુનો કરાર રદ ગણાશે તથા કરાર રીન્યુ ના કરેલ હોય તેવા સંજોગોમાં બેંક લોકર ધારકોને લોકર ઓપરેટ કરવાની મનાઈ કરી શકશે. તેથી હજુ પણ જેઓએ લોકરનો કરાર રીન્યુ ના કરાવેલ હોય તેઓએ બેંકમાં આવી કરાર રીન્યુ કરાવી લેવા વિનંતી કરવામાં આવે છે.

(૨) ભારત સરકારના ડીજીટલ ઈન્ડીયા અને કેશ લેશ વ્યવહાર મિશનના ભાગરૂપે આપણા ગ્રાહકોને ડીજીટલાઈઝેશનની સવલત મળે તે હેતુસર IMPS (ઈમીઝીએટ મોબાઈલ પેમેન્ટ સર્વિસ) યુનીફાઈડ પેમેન્ટ ઈન્ટરફેસ (UPI), રૂપે ડેબીટ કાર્ડ તથા ક્યુ.આર કોડ (QR Code) ચાલુ કરી દીધેલ છે જેનો ધણા ખાતેદારો તથા સભાસદોએ લાભ લીધેલ છે. બેંક ધ્વારા ભારત બીલ પેમેન્ટ સીસ્ટમ (BBPS) ની શરૂઆત કરવામાં આવેલ છે. ભારત બીલ પેમેન્ટ સીસ્ટમ (BBPS) માં ખાતેદારો મોબાઈલ બેકીંગ એપ અથવા બ્રાન્ચમાં રૂબરૂ આવી આ સેવાનો લાભ લઈ શકે છે તથા અન્ય વ્યક્તિ બ્રાન્ચમાં રૂબરૂ આવી આ સેવાનો લાભ લઈ શકે છે.

(૩) RTGS (રીયલ ટાઈમ ગ્રોસ સેટલમેન્ટ) NEFT (નેશનલ ઈલેક્ટ્રોનિક ફંડ ટ્રાન્સફર) થી આપ આપના નાણાં જમા તથા આપના અન્ય વ્યક્તિને પેમેન્ટ બેંકમાંથી કરી શકો છો.

બેંકના સરળ વહીવટ માટે જરૂરી સલાહ સુચનો તેમજ માર્ગદર્શન આપવા બદલ સ્ટેચ્યુટરી ઓડીટરશ્રી રાજેશભાઈ એન. શાહ એસોસીએટ્સ, જેતલપુર રોડ, વડોદરા તથા બેંકના કોન્કરન્ટ ઓડીટર શ્રી જીજ્ઞેશ પટણી એન્ડ એસોસીએટ્સ, તમામ લીગલ એડવાઈઝર્સ તથા બેંકના વેલ્યુઅર્સ શ્રી દીપકભાઈ તથા ડૉ. આઈ. આઈ. પંડ્યા સાહેબ તેમજ રીઝર્વ બેંક ઓફ ઈન્ડીયા અને તેના અર્બન બેંક વિભાગના અધિકારીશ્રીઓ, રજીસ્ટ્રારશ્રી ગાંધીનગર, જીલ્લા રજીસ્ટ્રારશ્રી સહકારી મંડળીઓ વડોદરા વિગેરે સર્વેનો આ પ્રસંગે હાર્દિક આભાર માનું છું.

મારા સાથી બોર્ડ ઓફ ડીરેક્ટર્સના સભ્યશ્રીઓ આપ સર્વે સભાસદશ્રીઓ, માનવતા થાપણદારો, ગ્રાહકો, શુભેચ્છકો તથા બેંકના સર્વે કર્મચારીઓના સાથ અને સહકારથી આપણી બેંક પ્રગતિ જાળવી રાખી છે તે બદલ આપ સર્વેની સાથે હું ગૌરવ અનુભવું છું.

અંતમાં આપણી બેંકનું ભવિષ્ય વધુ ને વધુ ઉજ્જવળ બને તથા બેંકની ઉત્તરોત્તર પ્રગતિ થાય તેવી શુભ કામનાઓ સાથે આપ સૌના સાથ અને સહકારની અપેક્ષા સાથે બેંક પ્રગતિ કરે તેવી પરમ કૃપાળુ પરમાત્માને પ્રાર્થના સાથે વિરમું છું.

હરેનભાઈ શંભુભાઈ પટેલ

પ્રમુખ

# ધી બરોડા સીટી કો-ઓપરેટીવ બેંક લી. વડોદરા.

ફીક્સ ડીપોઝીટના વ્યાજના દર (તા.05.06.2024થી ) અમલમાં

મુદત		વ્યાજનો દર
<b>ફીક્સ ડીપોઝીટના વ્યાજના દર</b>		
૧.	૪૫ દિવસ થી ૧૨ માસની અંદર	૫.૫૦%
૨.	૧૨ માસ થી ૨૪ માસ સુધી	૬.૭૫%
૩.	૨૪ માસ ૧ દિવસ થી ૬૦ માસ સુધી	૬.૩૦%
<b>સેવીફીક્સ ડીપોઝીટના વ્યાજના દર</b>		
૧.	૪૪ દિવસ સુધી	૨.૭૫%
૨.	૪૫ દિવસ થી ૧૮૦ દિવસ સુધી	૫.૦૦%
૩.	૧૮૧ દિવસ થી ૩૬૫ દિવસ સુધી	૫.૫૦%
*	ઘનવર્ષા ડીપોઝીટ ૭૩૦ દિવસ	૭.૨૫%
*	ઘનવર્ષા ડીપોઝીટ ૧૫ મહીના માટે	૭.૫૫%

નોંધ :

- ચેરીટેબલ કમિશનરમાં નોંધાયેલ ટ્રસ્ટ (રૂ. ૧૫.૦૦ લાખ કે તેથી વધુ ડીપોઝીટ ની પાવતી માટે) ને ૦.૫૦% વધારાનો લાભ ૧ વર્ષ કે તેથી વધુ સમય માટે ડીપોઝીટ મુકનારને મળશે.
- સીનીયર સીટીઝન ને ૦.૫૦% વધારાનો લાભ ૧ વર્ષ કે તેથી વધુ સમય માટે ડીપોઝીટ મુકનારને મળશે. ઘનવર્ષા ડીપોઝીટ સ્કીમ માં સદર લાભ મળશે નહીં.
- સેવિંગ્સ ખાતામાં તથા સભાસદ બચત ખાતામાં વ્યાજનો દર ૨.૭૫% પ્રમાણે રહેશે.
- ફીક્સ ડીપોઝીટમાં ૧ વર્ષ કે તેથી વધુ સમય માટે ડીપોઝીટ મુકનારને માસિક અથવા ત્રીમાસિક વ્યાજ મળશે. લક્ષ્મી ડીપોઝીટ (ચક્રવૃદ્ધિ વ્યાજ) ૧૨ માસ થી ૬૦ માસ સુધીમાં રોકાણ કરી શકાશે.
- ગુજરાત સરકારે તા.૦૧.૦૫.૧૯૬૧ થી બોમ્બે પબ્લીક ટ્રસ્ટ એક્ટની કલમ ૩૫(૧) હેઠળ ટ્રસ્ટની ડીપોઝીટ લેવાની મંજૂરી આપેલ છે.
- દરેક ફીક્સ ડીપોઝીટ પાકતી તારીખે ઓટો રીન્યુ થશે.

ધિરાણના વ્યાજ દર (તા.૦૫.૦૬.૨૦૨૪થી) અમલમાં

૧	ઓવરડ્રાફ્ટ ધિરાણના વ્યાજનો દર (રૂ. ૫૦,૦૦૦/- સુધી)	૧૨.૦૦%
૨	કેશક્રેડીટ, હાઈપોથીકેશન કેશ ક્રેડીટ, ટર્મ લોન, ધિરાણના વ્યાજના દર	
અ	કેશક્રેડીટ, હાઈપોથીકેશન કેશ ક્રેડીટ, નવી ટર્મ લોન	૧૦.૦૦%
બ	નવી શોર્ટટર્મ કેશક્રેડીટ તથા ટર્મલોન બીલ્ડર્સ (પ્રોજેક્ટ) (૩૬ માસ) માટે	૧૦.૫૦%
ક	નવી ટર્મલોન (હાલ માં ચાલુ છે તે લોનો - Floating) ( હવે થી ફ્લોટીંગ સ્કીમ બંધ કરેલ છે)	૯.૪૦%
ડ	નવી ગ્રુપ ડાઉન કેશક્રેડીટ (MSME)	૯.૫૦%
૩	પી.જી.એલ. ધિરાણ	૧૨.૦૦%
૪	આઈ.પી.એલ. પર્સનલ લોન રૂ. ૫૦,૦૦૦/- સુધી	૧૪.૦૦%
૫	હાયર પરચેઝ / આઈ.એચ.પી. ધિરાણ	
અ	Professional (C.A., Advocate, Doctor) (Four Wheeler)	૮.૩૦%
બ	ડોક્ટર માટે મશીનરી / કોર્મશીયલ વ્હીકલ ધિરાણ	૮.૮૦%
ક	કાર લોન ટુ વ્હીલર તથા કન્સ્યુમર ડ્યુરેબલ	૮.૫૦%
ડ	અન્ય માટે મશીનરી / કોર્મશીયલ વ્હીકલ ધિરાણ	૯.૫૦%
૬	નવીન સ્થાવર (હાઉસીંગ) ધિરાણ ના વ્યાજના દર (વેલ્યુએશન ના ૮૦% સુધી લોન)	
અ	નવુ મકાન ખરીદવા તથા રીનોવેશન માટે (હાલ માં ચાલુ છે તે લોનો - Floating) ( હવે થી ફ્લોટીંગ સ્કીમ બંધ કરેલ છે)	૮.૪૦%
બ	નવુ મકાન ખરીદવા તથા રીનોવેશન માટે (ફીક્સ રેટ)	
(૧)	રૂ. ૩૫.૦૦ લાખ સુધી	૮.૭૫%
(૨)	રૂ. ૩૫.૦૦ લાખ થી વધુ	૯.૨૫%
૭	<b>સ્થાવર ધિરાણ (મોર્ટગેજ) ના વ્યાજના દર</b>	
અ	શોર્ટ ટર્મ મોર્ટગેજ લોન (નવી દુકાન ખરીદવા, વેપાર વિ.) (૪૮ માસ માટે) ફીક્સ રેટ	૯.૫૦%
બ	મોર્ટગેજ લોન (નવી દુકાન ખરીદવા, વેપાર વિ.) ફીક્સ રેટ	૧૦.૦૦%
ક	મોર્ટગેજ લોન (ડોક્ટર માટે હોસ્પિટલ/કલીનીક, નવી દુકાન ખરીદવા, ઓફિસ/દુકાન રીનોવેશન, વેપાર વિ.) (હાલ માં ચાલુ છે તે લોનો - Floating) ( હવે થી ફ્લોટીંગ સ્કીમ બંધ કરેલ છે)	૯.૪૦%
ડ	મોર્ટગેજ લોન (ડોક્ટર માટે હોસ્પિટલ/કલીનીક, નવી દુકાન ખરીદવા, ઓફિસ/દુકાન રીનોવેશન, વેપાર વિ.) ફીક્સ રેટ	૯.૫૦%
૮	એજ્યુકેશન લોન (હાલ માં ચાલુ છે તે લોનો - Floating) ( હવે થી ફ્લોટીંગ સ્કીમ બંધ કરેલ છે)	૯.૧૦%
૯	એજ્યુકેશન લોન ફીક્સ રેટ	
અ	રૂ. ૨૦.૦૦ લાખ સુધી	૮.૮૦%
બ	રૂ. ૨૦.૦૦ લાખ થી વધુ	૯.૫૦%
૧૦	<b>દાગીના ધિરાણ દર</b>	
	(૧) એલ. એ. જી. (૧૨ માસ માટે)	૮.૭૫%
	(૨) જી. ટી. એલ. (૩૬ માસ માટે)	૮.૭૫%
૧૧	ગવર્નમેન્ટ સીક્યોરીટી ધિરાણ	૧૨.૦૦%

નોંધ -બાકી પડતા હપ્તા / વ્યાજ ઉપર પેનલ ચાર્જ ૨% પ્રમાણે લેવામાં આવશે.

## ઘી બરોડા સીટી કો-ઓપરેટીવ બેંક લી. વડોદરા.

### ખર્ચનું બજેટ :

સને 2024-25 ના વર્ષ દરમિયાન નીચે પ્રમાણેના ખર્ચનું બજેટ વ્યવસ્થાપક મંડળને વર્ગ ફેર કરવાના અધિકાર સહ મંજૂર કરવા ભલામણ છે.

અ. નં.	વિગત	સને 2023-24 ના વર્ષમાટેની અંદાજી રકમ રૂ.	સને 2023-24 ના વર્ષ દરમિયાન થયેલ ખર્ચની વિગત રૂ.	સને 2024-25 ના વર્ષમાટેની અંદાજી રકમ રૂ.
૧	પગાર અને ભથ્થા ભાડા તથા પ્રો.ફંડ	6,00,00,000.00	5,13,73,520.52	6,00,00,000.00
૨	ડાયરેક્ટર તથા સ્થાનિક સમિતિના સભ્યોની ફી તથા ભથ્થા ભાડા	1,00,000.00	49,200.00	1,00,000.00
૩	ભાડું, કર, વિમો, વિજળી વગેરે	65,00,000.00	68,01,235.36	75,00,000.00
૪	કોર્ટ તથા વકીલ ફી	8,00,000.00	4,24,200.00	6,00,000.00
૫	તાર, ટપાલ અને ટેલીફોન	7,00,000.00	6,75,472.14	8,00,000.00
૬	ઓડીટ ફી અને પ્રોફેશનલ ચાર્જ	16,00,000.00	13,78,004.68	15,00,000.00
૭	મિલકત મરામત તથા ઘસારા ખર્ચ	60,00,000.00	38,08,367.30	50,00,000.00
૮	સ્ટેશનરી છાપકામ અને જાહેરાત	10,00,000.00	7,58,959.67	9,00,000.00
૯	પરચુરણ ખર્ચ	15,00,000.00	3,43,908.93	7,00,000.00
૧૦	કોમ્પ્યુટર ખર્ચ	30,00,000.00	16,57,155.88	55,00,000.00
૧૧	આકસ્મિક ખર્ચ	20,000.00	0.00	20,000.00
	<b>કુલ રૂ.</b>	<b>8,12,20,000.00</b>	<b>6,72,70,024.48</b>	<b>8,26,20,000.00</b>

### નફો અને નફા ની વહેંચણી :

તા. 31.03.2024 ના રોજ પુરા થયેલ હિસાબી વર્ષના અંતે બેંકે રૂા 7,51,38,082.46નો કાચો નફો કરેલ છે.

જેમાથી જરૂરી પ્રોવિઝન ની રકમ રૂા. 3,95,88,837.48 ની ફાળવણી કરતા ચોખ્ખો નફો

રૂા. 3,55,49,244.98 કરેલ છે. બેંકના પેટા નિયમ ની જોગવાઈ અનુસાર નફાની ફાળવણી નીચે મુજબ કરવા

બોર્ડ ઓફ ડિરેક્ટર્સ ભલામણ કરી છે જે આપ સર્વે મંજૂરી આપશો.

#### નફાની ફાળવણી :

<b>ચોખ્ખો નફો</b>		<b>3,55,49,244.98</b>
૧ રીઝર્વ ફંડ (૨૫ % મુજબ)	88,87,311.25	
૨ શકમંદ લેણા ફંડ (૧૫ % મુજબ)	53,32,386.75	
૩ ડિવિડન્ડ (૧૦% મુજબ)	45,85,964.00	
૪ શિક્ષણ ફંડ (નિયમ મુજબ)	2,00,000.00	
<b>ફાળવણી (એ)</b>	<b>1,90,05,662.00</b>	
<b>બાકી રહેલો નફો</b>		<b>1,65,43,582.98</b>
૫ ડિવિડન્ડ ઈકવીલાઈઝેશન ફંડ (૯%)	14,88,922.47	
૬ કેળવણી અને વૈદકીય મદદ ફંડ (૧૦%)	16,54,358.30	
૭ ધર્માદા ફંડ (૧૦%)	16,54,358.30	
<b>ફાળવણી (બી)</b>	<b>47,97,639.07</b>	
<b>બાકી રહેલો નફો</b>		<b>1,17,45,943.91</b>
૮ ઈનવેસ્ટમેન્ટ ફલ્કચ્યુએશન રીઝર્વ	50,00,000.00	
૯ બીલ્ડીંગ ફંડ	50,00,000.00	
૧૦ સાયબર સીક્યુરીટી અનામત	10,00,000.00	
૧૧ નોન પરફોરમીંગ એસેટ રીઝર્વ	7,45,943.91	
<b>ફાળવણી (સી)</b>	<b>1,17,45,943.91</b>	
<b>કુલ ફાળવણી (એ + બી + સી)</b>		<b>3,55,49,244.98</b>



## **AUDITOR'S REPORT**

To,  
The Members,  
The Baroda City Co. Operative Bank Ltd.,  
Baroda — 390 001

### **Report on the Financial Statements**

We have audited the accompanying financial Statements of The Baroda City Co. Operative Bank Ltd., Baroda as at 31 March 2024 which comprises the Balance Sheet as at 31 March 2024 and the Profit and Loss Account, and the Cash Flow Statement for the year ended and a summary of significant accounting policies and other explanatory information. The returns of eight branches including Head Office audited by us are incorporated in these financial statements.

### **Management's Responsibility for the Financial Statement**

1. Management is responsible for the preparation of these financial statement that give a true and fair view of the financial position, financial performance and cash flows of the Bank in accordance with banking regulation Act, 1949 (as applicable to cooperatives societies), the guidelines issued by Reserve Bank of India and the guidelines issued by the National Bank for Agricultural and Rural Development, the Registrar of cooperative Societies, Gujarat, the Gujarat Co- operative Societies Act, 1961 and the Gujarat Co-operative Societies Rules,1965 and generally accepted accounting principles in India so far as applicable to the Bank. This responsibility includes design, implementation and maintenance of internal control relevant to the financial statements that are free from material misstatement, whether due to fraud or error.

### **Auditor's Responsibility**

2. Our responsibility is to express an opinion on these financial statements based on our audit. We conducted our audit in accordance with the Standards on Auditing issued by the institute of Chartered Accountants of India. Those Standards require that we comply with ethical requirements and plan and perform the audit to obtain reasonable assurance about whether the financial statements are free from material misstatement.
3. An audit involves performing procedures to obtain audit evidence about the amounts and the disclosures in the financial statements. The procedures selected depend on the auditor's judgment, including the assessment of the risks of material misstatement of the financial statements, whether due to fraud or error. In making those risk assessments, the auditor considers internal control relevant to the Bank's preparation and fair presentation of the financial statements in order to design audit procedures that are appropriate in the circumstances, but not for the purpose of expressing an opinion on effectiveness of the entity's internal control. An audit also includes evaluating the appropriateness of accounting policies used and the reasonableness of the accounting estimates made by management, as well as evaluating the overall presentation of the financial statements.
4. We believe that the audit evidence we have obtained is sufficient and appropriate to provide a basis for our audit opinion.

# THE BARODA CITY CO-OPERATIVE BANK LTD - VADODARA

## Opinion

5. In our opinion and to the best of our information and according to the explanations given to us, the financial statements together with the Notes thereon give the information required by the Banking Regulation Act, 1949 (as applicable to co-operative societies), the Gujarat Co-operative Societies Act, 1961 the guidelines issued by the Reserve Bank of India and the Registrar of cooperative Societies in the manner so required and give a true and fair view in conformity with the accounting principles generally accepted in India:
  - (a) In the case of the Balance Sheet, of state of affairs of the Bank as at 31st March 2024;
  - (b) In the case of the Profit & Loss Account, of the Profit for the year ended on that date; and
  - (c) In the case of the Cash Flow statement, of the cash flows for the year ended on that date.Report on Other Legal and Regulatory Requirements:
6. The Balance Sheet and the Profit and Loss Account have been drawn up in Forms "A" and "B" respectively of the third schedule to the Banking Regulation Act, 1949 and provisions of The Gujarat Co-operatives Societies Act, 1961 and Gujarat Co-operatives Societies Rules, 1965.
7. **We report that:**
  - (a) We have obtained all the information and explanation which to the best of our knowledge and belief were necessary for the purpose of our audit and have found to be satisfactory.
  - (b) In our opinion, proper books of accounts as required by law have been kept by the Bank so far as it appears from our examination of those books and proper returns adequate for the purposes of our audit have been received from the branches/ offices.
  - (c) The transactions of the Bank which have come to our notice are within the powers of the Bank.
  - (d) The Balance Sheet and Profit & Loss dealt with by this report, are in agreement with the books of account and the returns.
  - (e) The accounting standards adopted by the Bank are consistent with those laid down by accounting principles generally accepted in India so far as applicable to Banks.
8. We further report that for the year under audit, the Bank has been awarded "A" classification.

**FOR R N SHAH ASSOCIATES  
CHARTERED ACCOUNTANTS  
FRN: 112511W**

**CA KINTAN D. MOHITE  
PARTNER**

**MRN: 131678**

**PANEL NO. 09**

**UDIN: 24131678BKEHIK8428**

Date: 30.05.2024

Place: VADODARA

# THE BARODA CITY CO-OPERATIVE BANK LTD - VADODARA

The Banking Regulation Act, 1949 (As Applicable to Co-operative Societies)

Form B

Profit and Loss Account for the year ended on 31-03-2024

31.03.2023		31.03.2024	31.03.2024
Rs. Ps.	EXPENDITURE	Rs. Ps.	Rs. Ps.
14,66,94,108.65	1 Interest on Deposits, Borrowings, etc.		16,59,98,829.96
5,67,39,465.60	2 Salaries and Allowances and Provident Fund		5,13,73,520.52
37,200.00	3 Directors' and Local Committee Members Fees and Allowances		49,200.00
58,26,797.08	4 Rent, Taxes, Insurance, Electricity, etc.		68,01,235.36
7,40,972.00	5 Law Charges		4,24,200.00
6,69,756.66	6 Postage, Telegram and Telephone Charges		6,75,472.14
6,61,824.34	7 Audit Fees		4,15,308.00
50,78,888.00	8 Depreciation and Repairs to Property		38,08,367.30
7,05,725.10	9 Stationery, Printing and Advertisement, etc.		7,58,959.67
0.00	10 Loss from Sale of or Dealing with Non-banking Assets Other Expenditure & Provision		0.00
65,06,274.55	11 Other Expenses - As Per Schedule 5		50,83,036.29
6,23,55,122.67	12 Provisions - As Per Schedule 6		3,95,88,837.48
3,75,35,283.20	13 Balance of Profit		3,55,49,244.98
<b>32,35,51,417.85</b>	<b>TOTAL</b>		<b>31,05,26,211.70</b>

Shri Harenbhai Sambhubhai Patel  
(Chairman)

CA Shri Samirbhai Ranchhodlal Parikh  
(Vice – Chairman)

Shri Vivekbhai Narendrabhai Patel  
(M.D Professional Director)

CA Shri Kiritkumar Rasikbhai Amin  
(Jt. Secretary-Professional Director)

Shri Kantibhai Dahyabhai Patel  
(Professional Director)

Shri Harshadbhai Ranchhodbhai Patel  
(Professional Director)

Shri Rashipbhai Upendrabhai Patel

Shri Maulinbhai Mukundbhai Patel

Smt. Dinaben Harenbhai Patel

Smt. Hemaxiben Shreyasbhai Patel

Shri Thakorabhai Ambalal Parmar

Shri Satyen S Patel (CEO)

# THE BARODA CITY CO-OPERATIVE BANK LTD - VADODARA

The Banking Regulation Act, 1949 (As Applicable to Co-operative Societies)

Form B

Profit and Loss Account for the year ended on 31-03-2024

31.03.2023	Income	31.03.2024	31.03.2024
Rs. Ps.		Rs. Ps.	Rs. Ps.
28,13,15,736.53	1 Interest and Discount etc.		27,78,78,533.22
	Total Interest Received	29,81,31,102.67	
	Less : Interest Paid Purchase Govt Sec	2,02,52,569.45	
	Net Interest and Discount etc.	27,78,78,533.22	
7,14,640.17	2 Commission, Exchange and Brokerage		7,61,111.67
0.00	3 Subsidies and Donations		0.00
0.00	4 Income from Non-banking Assets and Profit from Sale or Dealing with such Assets		0.00
4,15,21,041.15	5 Other Receipts - As Per Schedule 7		3,18,86,566.81
32,35,51,417.85	Total		31,05,26,211.70

AS PER OUR AUDIT REPORT OF EVEN DATE

Date: 30-05-2024  
VADODARA

FOR R N SHAH ASSOCIATES  
CHARTERED ACCOUNTANTS  
FRN: 112511W

CA KINTAN D MOHITE  
PARTNER  
MRN: 131678  
UDIN: 24131678BKEHIK8428  
PANEL NO: 09

# THE BARODA CITY CO-OPERATIVE BANK LTD - VADODARA

The Banking Regulation Act, 1949 (As Applicable to Co-operative Societies)

THE THIRD SCHEDULE (See Section 29)

FORM A

Balance Sheet As On 31-03-2024

31.03.2023	CAPITAL AND LIABILITIES	31.03.2024	31.03.2024
Rs. Ps.		Rs. Ps.	Rs. Ps.
<b>7,00,00,000.00</b>	<b>1 Capital</b>		<b>10,00,00,000.00</b>
	<b>1 (i) Authorised Capital</b>	<b>10,00,00,000.00</b>	
	1,00,00,000 shares of Rs. 10/- each		
<b>4,66,94,130.00</b>	<b>2 (ii) Subscribed Capital</b>		<b>4,90,80,660.00</b>
	49,08,066 shares of Rs. 10 /- each		
	1 Individuals	4,90,80,660.00	
	2 Co-operative institutions	0.00	
	3 State Government	0.00	
<b>69,23,77,866.14</b>	<b>2 Reserve Fund and Other Reserves (schedule-1)</b>		<b>73,50,72,046.52</b>
	1 Statutory Reserve	11,26,08,618.18	
	2 Special Reserve	5,69,75,789.22	
	3 Building Fund	1,96,90,161.93	
	4 Education and Medical Relief Fund	97,06,009.37	
	5 Dividend Equilisation Fund	1,02,72,201.57	
	6 Charity Fund	77,84,059.99	
	7 Investment Fluctuation Reserve	6,60,49,295.81	
	8 Investment Depreciation Fund	0.00	
	9 Staff Welfare Fund	73,327.45	
	10 NPA Reserve Fund	13,97,79,295.83	
	11 Contingent Provision against Std Assets	85,00,000.00	
	12 Bad & Doubtful Debts Reserve	2,07,63,369.17	
	13 Provision for NPA Investment	9,41,77,968.00	
	14 Satabdi Mahotsav Fund	3,00,00,000.00	
	15 Cyber Security Fund	50,00,000.00	
	16 Building Revaluation Reserve	15,36,91,950.00	
<b>0.00</b>	<b>3 Principal/Subsidiary State Partnership Fund Account</b>		<b>0.00</b>
	1 Central co-operative banks		
	2 Primary agricultural credit societies		
	3 Other societies		
<b>3,20,09,20,001.49</b>	<b>4 Deposit and Other Accounts (schedule-2)</b>		<b>3,36,47,35,799.63</b>
	<b>1 (i) Fixed deposits</b>	<b>2,55,12,96,567.78</b>	
	<b>a Individual</b>		
		2,29,26,56,173.78	
	<b>b Central Co operative Banks</b>		
	<b>c Other Societies</b>		
		25,86,40,394.00	
	<b>2 Saving Bank Deposits</b>	<b>67,70,53,819.62</b>	
	<b>a Individual</b>		
		63,23,57,180.02	
	<b>b Central Co operative Banks</b>		
	<b>c Other Societies</b>		
		4,46,96,639.60	
<b>3,93,99,91,997.63</b>	<b>Balance Carried Forward</b>		<b>4,14,88,88,506.15</b>



# THE BARODA CITY CO-OPERATIVE BANK LTD - VADODARA

The Banking Regulation Act, 1949 (As Applicable to Co-operative Societies)

THE THIRD SCHEDULE (See Section 29)

FORM A

Balance Sheet As On 31-03-2024

31.03.2023	PROPERTY AND ASSETS	31.03.2024	31.03.2024
Rs. Ps.		Rs. Ps.	Rs. Ps.
<b>2,25,21,622.58</b>	<b>1 Cash</b>		<b>5,15,21,477.28</b>
	Cash on Hand	1,71,84,204.28	
	The Gujarat State Co.Op.Bank Ltd., C. A/c	20,00,000.00	
	Baroda Central Co-op Bank Ltd., C. A/c.	54,99,970.00	
	State Bank of India, Dandiabazar, C. A/c.	2,68,37,303.00	
<b>58,43,81,382.39</b>	<b>2 Balance with other banks</b>		<b>64,71,32,506.24</b>
	<b>1 Current deposits</b>		
	Bank of Baroda, Raopura,Vadodara C. A/c	40,00,000.00	
	UCO Bank, Raopura, Vadodara C. A/c	5,99,945.00	
	IDBI Bank, Vadodara, C. A/c	9,36,50,000.00	
	IDBI Bank, Vadodara, C. A/c (Clearing)	5,85,63,023.25	
	HDFC Bank, Vadodara, C. A/c	2,35,35,621.56	
	HDFC Bank Vadodara ATM & IMPS Settlement	63,81,452.40	
	HDFC Bank Vadodara UPI Settlement	64,60,396.19	
	ICICI Bank Vadodara C. A/c	56,92,809.50	
	Kotak Mahindra Bank, Vadodara, C. A/c	1,23,57,951.64	
	Bank Of Maharashtra Alkapuri Vadodara C. A/c	1,08,23,167.70	
		<b>22,20,64,367.24</b>	
	<b>2 Savings bank deposits</b>	<b>0.00</b>	
	<b>3 Fixed deposits</b>		
	The Gujarat State Co.Op.Bank Ltd., FD	4,00,00,000.00	
	The Baroda Central Co-op Bank Ltd., C. A/c.	5,00,00,000.00	
	Bank of Baroda, Raopura, FD	6,00,00,000.00	
	ICICI Bank FD	5,00,00,000.00	
	State Bank Of India, Dandia Bazar, FD	4,48,00,000.00	
	HDFC Bank, Vadodara, FD	8,60,90,471.00	
	Madhavpura Merc. Co.op. Bank,Shahibaug, FD	99,16,689.00	
	Madhavpura Merc. Co.op. Bank,Ellisbridge, FD	8,42,60,979.00	
		<b>42,50,68,139.00</b>	
<b>2,50,00,000.00</b>	<b>3 Money at call and short notice</b>		<b>0.00</b>
<b>1,58,46,72,281.18</b>	<b>4 Investments</b>		<b>1,57,47,60,207.51</b>
	<b>1 In Central and State Government securities,T Bill (book value) (schedule-3)</b>	1,49,84,94,774.39	
	<b>2 Other Trustee securities</b>	0.00	
	<b>3 Shares in co-operative institutions other than in item (schedule-3a)</b>	32,800.00	
	<b>4 Other investments (to be specified) (Mutual Fund) (schedule-3b)</b>	5,62,27,633.12	
	<b>5 PSU Bonds (schedule-3c)</b>	2,00,05,000.00	
<b>2,21,65,75,286.15</b>	<b>Balance Carried Forward</b>		<b>2,27,34,14,191.03</b>



# THE BARODA CITY CO-OPERATIVE BANK LTD - VADODARA

The Banking Regulation Act, 1949 (As Applicable to Co-operative Societies)  
THE THIRD SCHEDULE (See Section 29)  
FORM A

Balance Sheet As On 31-03-2024

31.03.2023	PROPERTY AND ASSETS	31.03.2024	31.03.2024
Rs. Ps.		Rs. Ps.	Rs. Ps.
2,21,65,75,286.15	Balance Brought Forward		2,27,34,14,191.03
	<b>5 Investments out of the Principal/Subsidiary</b>	0.00	
	<b>State Partnership Fund In shares of :</b>		
	<b>1</b> Central co-operative banks		
	<b>2</b> Primary agricultural credit societies		
	<b>3</b> Other societies		
1,60,21,80,943.13	<b>6 Advances (Schedule-4)</b>		1,71,43,24,391.13
	<b>1</b> Short-term loans, cash credits, overdrafts and bills discounted	43,56,05,082.22	
	Of which secured against:		
	<b>a</b> Government and other approved securities	0.00	
	<b>b</b> Other tangible securities	43,51,94,106.22	
	<b>c</b> Unsecured	4,10,976.00	
	<b>Of the advances (1)</b>		
	<b>a</b> Individual		
		43,56,05,082.22	
	<b>b</b> Amount Overdue		
		2,94,66,500.00	
	<b>c</b> Considered bad and doubtful of recovery		
		0.00	
	<b>2</b> Medium-term loans	85,99,83,084.71	
	<b>a</b> Government and other approved securities	0.00	
	<b>b</b> Other tangible securities	85,40,69,287.79	
	<b>c</b> Unsecured	59,13,796.92	
	<b>Of the advances (2)</b>		
	<b>a</b> Individual		
		85,99,83,084.71	
	<b>b</b> Amount Overdue		
		2,50,15,000.00	
	<b>c</b> Considered bad and doubtful debt of recovery		
		2,11,55,600.00	
	<b>3</b> Long-term loans	41,87,36,224.20	
	<b>a</b> Government and other approved securities	0.00	
	<b>b</b> Other tangible securities	41,87,36,224.20	
	<b>c</b> Unsecured	0.00	
3,81,87,56,229.28	<b>Balance Carried Forward</b>		3,98,77,38,582.16

# THE BARODA CITY CO-OPERATIVE BANK LTD - VADODARA

The Banking Regulation Act, 1949 (As Applicable to Co-operative Societies)

THE THIRD SCHEDULE (See Section 29)

FORM A

Balance Sheet As On 31-03-2024

31.03.2023	CAPITAL AND LIABILITIES	31.03.2024	31.03.2024
Rs. Ps.		Rs. Ps.	Rs. Ps.
3,93,99,91,997.63	Balance Brought Forward		4,14,88,88,506.15
	b Medium-term loans		
	1) Government and other approved securities		
	2) Other tangible securities		
	c Long-term loans		
	1) Government and other approved securities		
	2) Other tangible securities		
	<b>3 From the State Government</b>		
	a Short-term loans, cash credits and overdrafts Of which secured against:		
	1) Government and other approved securities		
	2) Other tangible securities		
	b Medium-term loans		
	1) Government and other approved securities		
	2) Other tangible securities		
	c Long-term loans		
	1) Government and other approved securities		
	2) Other tangible securities		
	<b>4 Loans from other sources</b>		
	(source and security to be specified)		
0.00	<b>6 Bills for Collection</b>		0.00
	(Being Bills Receivable as per contra)		
0.00	<b>7 Branch Adjustments</b>		0.00
25,40,61,053.73	<b>8 Overdue Interest Reserve</b>		24,48,17,256.67
	1 Interest Suspense	0.00	
	2 NPA Int.Receivable (Contra)	24,48,17,256.67	
4,19,40,53,051.36	<b>Balance Carried Forward</b>		4,39,37,05,762.82

# THE BARODA CITY CO-OPERATIVE BANK LTD - VADODARA

The Banking Regulation Act, 1949 (As Applicable to Co-operative Societies)  
THE THIRD SCHEDULE (See Section 29)  
FORM A

Balance Sheet As On 31-03-2024

31.03.2023	PROPERTY AND ASSETS	31.03.2024	31.03.2024
Rs. Ps.		Rs. Ps.	Rs. Ps.
<b>3,81,87,56,229.28</b>	Balance Brought Forward		<b>3,98,77,38,582.16</b>
	<b>Of the advances (3)</b>		
	a Individual		
	41,87,36,224.20		
	b Amount Overdue		
	14,24,700.00		
	c Considered bad and doubtful of recovery		
	3,67,000.00		
<b>3,51,17,715.82</b>	<b>7 Interest Receivable</b>		<b>4,12,04,837.15</b>
	a Bank FDR & Investment	4,12,04,837.15	
	b Considered bad and doubtful debts of recovery	0.00	
<b>25,40,61,053.73</b>	<b>8 Overdue Interest Reserve (NPA Interest Receivable ) (Contra)</b>		<b>24,48,17,256.67</b>
<b>0.00</b>	<b>9 Bills Receivable</b>		<b>0.00</b>
	(Being Bills for Collections as per contra)		
<b>0.00</b>	<b>10 Branch Adjustments</b>		<b>0.00</b>
<b>1,06,86,938.17</b>	<b>11 Land &amp; Building</b>		<b>1,01,66,743.07</b>
	Opening Balance	1,06,86,938.17	
	Add: New Renovation and Construction	14,393.90	
	Less : Depreciation	5,34,589.00	
<b>16,17,81,000.00</b>	<b>11A BUILDING REVALUATION</b>	<b>15,36,91,950.00</b>	<b>15,36,91,950.00</b>
<b>1,01,32,659.04</b>	<b>12 Furniture &amp; Fixtures</b>		<b>93,62,891.04</b>
	Opening Balance	1,01,32,659.04	
	Add: Addition During the Year	18,151.00	
		1,01,50,810.04	
	Less : Round Off During the Year	1.00	
	Less : Depreciation	7,87,918.00	
<b>7,98,574.20</b>	<b>13 Vehicle</b>		<b>6,38,859.20</b>
	Opening Balance	7,98,574.20	
	Add: Round Off During the Year	0.00	
		7,98,574.20	
	Less : Deduction During the Year	0.00	
	Less : Depreciation	1,59,715.00	
<b>4,29,13,34,170.24</b>	<b>Balance Carried Forward</b>		<b>4,44,76,21,119.29</b>



# THE BARODA CITY CO-OPERATIVE BANK LTD - VADODARA

The Banking Regulation Act, 1949 (As Applicable to Co-operative Societies)  
THE THIRD SCHEDULE (See Section 29)  
FORM A  
Balance Sheet As On 31-03-2024

31.03.2023	CAPITAL AND LIABILITIES	31.03.2024	31.03.2024
Rs. Ps.		Rs. Ps.	Rs. Ps.
4,19,40,53,051.36	Balance Brought Forward		4,39,37,05,762.82
44,25,979.00	9 Interest Payable		52,72,693.00
8,52,37,877.63	10 Other Liabilities		6,60,29,265.39
	1 Dividend Payable A/c.	7,48,480.77	
	2 Suspense A/c.	2,29,236.00	
	3 Share Holder's Gift A/c.	1,84,34,860.67	
	4 Leave Encashment Payable A/c.	2,44,73,608.07	
	5 Nominal Membership Fees A/c.	1,160.00	
	6 Income Tax Reserved A/c.	1,16,07,203.66	
	7 Differed Tax Liability A/c.	50,88,129.00	
	8 Professional Tax A/c.	6,600.00	
	9 TDS Anamat (General) A/c.	16,78,657.00	
	10 Pay Order A/c.	3,84,828.30	
	11 Provision Expenses A/c.	2,78,997.40	
	12 Staff Gratuity Fund	2,47,191.00	
	13 Staff Providant Fund A/c.	6,48,530.00	
	14 Income Tax Deduction (Staff) A/c.	6,92,300.00	
	15 Unclaimed Pay Order / Draft A/c.	87,594.82	
	16 CGST (9%) Payable	7,00,593.25	
	17 SGST (9%) Payable	6,03,458.25	
	18 IGST Payable	98,743.20	
	19 TDS On Cash Withdrawal	19,094.00	
3,75,35,283.20	11 Profit and Loss		3,55,49,244.98
	Profit as per last balance sheet	3,75,35,283.20	
	Less: Appropriations	3,75,35,283.20	
		0.00	
	Add: Profit for the year brought from the Profit and Loss A/c	3,55,49,244.98	
	12 Contingent Liabilities:-		
	1 Others - Depositors Education & Awareness Fund Current Year DEAF	2,69,55,348.37	
	2 Others - NPA Charges Receivable Contra	4,899.16	
4,32,12,52,191.19	<b>TOTAL</b>		4,50,05,56,966.19

**Shri Harenbhai Sambhubhai Patel**  
(Chairman)

**CA Shri Samirbhai Ranchhodlal Parikh**  
(Vice – Chairman)

**Shri Vivekbhai Narendrabhai Patel**  
(M.D Professional Director)

**CA Shri Kiritkumar Rasikbhai Amin**  
(Jt. Secretary-Professional Director)

**Shri Kantibhai Dahyabhai Patel**  
(Professional Director)

**Shri Harshadbhai Ranchhodbhai Patel**  
(Professional Director)

**Shri Rashipbhai Upendrabhai Patel**

**Shri Maulinbhai Mukundbhai Patel**

**Smt. Dinaben Harenbhai Patel**

**Smt. Hemaxiben Shreyasbhai Patel**

**Shri Thakorbhai Ambalal Parmar**

**Shri Satyen S Patel (CEO)**

# THE BARODA CITY CO-OPERATIVE BANK LTD - VADODARA

The Banking Regulation Act, 1949 (As Applicable to Co-operative Societies)  
THE THIRD SCHEDULE (See Section 29)  
FORM A

Balance Sheet As On 31-03-2024

31.03.2023	PROPERTY AND ASSETS	31.03.2024	31.03.2024
Rs. Ps.		Rs. Ps.	Rs. Ps.
4,29,13,34,170.24	Balance Brought Forward		4,44,76,21,119.29
20,07,397.48	<b>14 Computer</b>		10,22,199.68
	Opening Balance	20,07,397.48	
	Add: Addition During the Year	5,29,758.20	
		25,37,155.68	
	Less : Deduction During the Year	0.00	
	Less : Depreciation	15,14,956.00	
5,33,324.42	<b>15 Solar system</b>		2,58,566.42
	Opening Balance	5,33,324.42	
	Add: Addition During the Year	42,560.00	
		5,75,884.42	
	Less : Depreciation	3,17,318.00	
2,73,77,299.05	<b>16 Other Assets (to be specified)</b>		5,16,55,080.80
	<b>1</b> Deposit (MGVCL)	95,660.00	
	<b>2</b> Stamp Stock	41,100.00	
	<b>3</b> Franking Account	1,48,515.00	
	<b>4</b> Silver Coin Stock	12,72,580.65	
	<b>5</b> DEA Fund 2014 Receivable	1,71,033.05	
	<b>6</b> DEA Fund Interest Receivable	23,431.00	
	<b>7</b> Advance Vendor Payment	7,980.00	
	<b>8</b> TDS	2,36,850.54	
	<b>9</b> CGST (9%)Receivable	1,30,808.76	
	<b>10</b> SGST (9%)Receivable	1,30,808.76	
	<b>11</b> IGST Receivable	7,24,398.71	
	<b>12</b> Differed Tax Asset	9,00,269.00	
	<b>13</b> Advance Income Tax (2023-24)	1,00,00,000.00	
	<b>14</b> BBPS - Sarvatra E-hub	2,74,145.33	
	<b>15</b> SIDBI Deposit	3,74,97,500.00	
4,32,12,52,191.19	<b>TOTAL</b>		4,50,05,56,966.19

AS PER OUR AUDIT REPORT OF EVEN DATE

Date: 30-05-2024  
VADODARA

FOR R N SHAH ASSOCIATES  
CHARTERED ACCOUNTANTS  
FRN: 112511W

CA KINTAN D MOHITE  
PARTNER  
MRN: 131678  
UDIN: 24131678BKEHIK8428  
PANEL NO: 09

# THE BARODA CITY CO-OPERATIVE BANK LTD - VADODARA

## Mandatory Disclosures and Notes on Accounts in terms of RBI

Circular No. RBI/DOR2021-22 /83 DOR.ACC.REC.NO. 45/21.04.018/2021-22 as on August 30, 2021

**FOR YEAR 2023-2024**

### Annexure – 1 BUSINESS SEGMENTS:

**Current FY 2023-24**

(Amt.in Crore)

Business Segments -->	Treasury	Banking Operations	Enterprise as Whole (unallocable)	Total
Revenue	-	33.07	-	33.07
Expenses	-	25.56	-	25.56
Operating Profit	-	7.51	-	7.51
Less: Tax Provision & Other Provision				3.96
Prior Period Income (Expense)				0.00
Net Profit				3.55

Segment Assets	227.34	171.43	26.81	425.58
Segment Liabilities	78.42	336.47	10.69	425.58

**Previous FY 2022-23**

(Amt.in Crore)

Business Segments -->	Treasury	Banking Operations	Enterprise as Whole (unallocable)	Total
Revenue	-	33.82	-	33.82
Expenses	-	23.82	-	23.82
Operating Profit	-	10.00	-	10.00
Less: Tax Provision & Other Provision				6.25
Prior Period Income (Expense)				0.00
Net Profit				3.75

Segment Assets	198.96	160.22	47.54	406.72
Segment Liabilities	73.91	320.09	12.72	406.72

**Note :** The Geographical segment disclosure is not required since the Bank caters mainly to the need of Individual customers.

### Annexure – 2 REGULATORY CAPITAL:

#### a) Composition of Regulatory Capital

(Amt.in Crore)

Sr. No.	Particulars	Current FY 2023-24	Previous FY 2022-23
i)	Paid up Share Capital and Reserves	16.17	14.53
ii)	Other Tier 1 Capital	11.22	6.22
iii)	Total Tier 1 Capital (i+ii)	27.39	24.50
iv)	Total Tier 2 Capital	15.88	23.40
v)	Total Capital (Tier 1 + Tier 2)	43.27	47.90
vi)	Total Risk Weighted Assets (RWAs)	188.87	205.99
vii)	Paid-up Share Capital and Reserves as Percentage of RWAs	8.56	7.05%
viii)	Tier 1 Ratio (Tier 1 Capital as a percentage of RWAs)	14.50	11.89%
ix)	Tier 2 Ratio (Tier 2 Capital as a percentage of RWAs)	8.40	11.35%
x)	Capital to Risk Weighted Assets Ratio (CRAR) (Total Capital as a Percentage of RWAs)	22.91	23.25%
xi)	Net worth	35.02	42.92

# THE BARODA CITY CO-OPERATIVE BANK LTD - VADODARA

## Annexure – 3 ASSET LIABILITY MANAGEMENT:

### a) Maturity Pattern of Certain Items of Assets and Liabilities (Current FY 2023-24)

(Amt.in Crore)

Particulars	Day 1	2 To 7 Days	8 To 14 Days	15 To 30 Days	31 Days to 2 Months	Over 2 Months to 3 Months	Over 3 Months to 6 Months	Over 6 Months to 1 Year	Over 1 Year to 3 years	Over 3 Year to 5 years	Over 5 Years	Total
Deposits	96.90	0.12	0.13	4.93	8.26	16.17	53.78	76.78	78.86	0.54	0.00	336.47
Advances	5.23	0.02	0.09	0.21	3.28	3.81	2.66	13.37	18.39	29.24	95.13	171.43
Investments	15.04	0.00	0.00	2.00	0.00	0.50	0.11	27.98	39.70	9.44	105.22	199.99
Borrowings	0.00	0.00	0.00	0.00	0.00	0.00	0.00	0.00	0.00	0.00	0.00	0.00

### a) Maturity Pattern of Certain Items of Assets and Liabilities (Previous FY 2022-23)

(Amt.in Crore)

	Day 1	2 To 7 Days	8 To 14 Days	15 To 30 Days	31 Days to 2 Months	Over 2 Months to 3 Months	Over 3 Months to 6 Months	Over 6 Months to 1 Year	Over 1 Year to 3 years	Over 3 Year to 5 years	Over 5 Years	Total
Deposits	20.98	0.08	0.05	0.96	7.72	13.77	32.32	53.67	187.58	1.76	1.20	320.09
Advances	5.12	0.14	0.08	0.44	3.00	4.91	9.85	16.87	26.82	46.97	46.02	160.22
Investments	12.51	7.48	4.98	0.00	0.50	3.00	7.50	15.49	17.10	30.62	99.79	198.97
Borrowings	0.00	0.00	0.00	0.00	0.00	0.00	0.00	0.00	0.00	0.00	0.00	0.00

## Annexure – 4 INVESTMENTS:

### a) Composition of Investment Portfolio:

#### i. Current FY 2023-24

(Amt.in Crore)

	Investments in India							Total Investments in India
	Government Securities	Other Approved Securities	Shares	Debentures and Bonds	Subsidiaries and/or Joint Ventures	Others		
<b>Held to Maturity</b>								
Gross	35.88	5.02	0.00	0.00	0.00	0.00	40.90	
Less : Provision for Non-Performing Investment (NPI)	0.00	0.00	0.00	0.00	0.00	0.00	0.00	
Net	35.88	5.02	0.00	0.00	0.00	0.00	40.90	
<b>Available for Sale</b>								
Gross	37.99	70.97	0.00	2.00	0.00	5.62	116.58	
Less : Provision for Depreciation and NPI	0.00	0.00	0.00	0.00	0.00	0.00	0.00	
Net	37.99	70.97	0.00	2.00	0.00	5.62	116.58	
<b>Held for Trading</b>								
Gross	0.00	0.00	0.00	0.00	0.00	0.00	0.00	

## THE BARODA CITY CO-OPERATIVE BANK LTD - VADODARA

Less : Provision for Depreciation and NPI	0.00	0.00	0.00	0.00	0.00	0.00	0.00
Net	0.00	0.00	0.00	0.00	0.00	0.00	0.00
<b>Total Investments</b>	<b>73.87</b>	<b>75.99</b>	<b>0.00</b>	<b>2.00</b>	<b>0.00</b>	<b>5.62</b>	<b>157.48</b>
Less : Provision for Non-Performing Investments	0.00	0.00	0.00	0.00	0.00	0.00	0.00
Less : Provision for Depreciation	0.00	0.00	0.00	0.00	0.00	0.00	0.00
Net	<b>73.87</b>	<b>75.99</b>	<b>0.00</b>	<b>2.00</b>	<b>0.00</b>	<b>5.62</b>	<b>157.48</b>

### ii. Previous FY 2022-23

(Amt.in Crore)

	Investments in India						
	Government Securities	Other Approved Securities	Shares	Debentures and Bonds	Subsidiaries and/or Joint Ventures	Others	Total Investments in India
<b>Held to Maturity</b>							
Gross	53.62	5.00	0.00	0.00	0.00	0.00	58.62
Less : Provision for Non-Performing Investment (NPI)	0.00	0.00	0.00	0.00	0.00	0.00	0.00
Net	53.62	5.00	0.00	0.00	0.00	0.00	58.62
<b>Available for Sale</b>							
Gross	18.36	66.97	0.00	2.00	0.00	12.51	99.84
Less : Provision for Depreciation and NPI	0.00	0.00	0.00	0.00	0.00	0.00	0.00
Net	18.36	66.97	0.00	2.00	0.00	12.51	99.84
<b>Held for Trading</b>							
Gross	0.00	0.00	0.00	0.00	0.00	0.00	0.00
Less : Provision for Depreciation and NPI	0.00	0.00	0.00	0.00	0.00	0.00	0.00
Net	0.00	0.00	0.00	0.00	0.00	0.00	0.00
<b>Total Investments</b>							
Less : Provision for Non-Performing Investments	0.00	0.00	0.00	0.00	0.00	0.00	0.00
Less : Provision for Depreciation	0.00	0.00	0.00	0.00	0.00	0.00	0.00
<b>Net</b>	<b>71.98</b>	<b>71.97</b>	<b>0.00</b>	<b>2.00</b>	<b>0.00</b>	<b>12.51</b>	<b>158.46</b>



# THE BARODA CITY CO-OPERATIVE BANK LTD - VADODARA

## Annexure – 5 Movement of Provisions for Depreciation and Investment Fluctuation Reserve

(Amt.in Crore)

Particulars	Current FY 2023-24	Previous FY 2022-23
<b>i) Movement of Provisions held towards depreciation on Investments</b>		
a) Opening Balance	1.63	1.38
b) Add : Provision made during the Year	0.15	0.25
c) Less : Write off/Write back of excess provisions During the Year	1.78	0.00
d) Closing Balance	0.00	1.63
<b>ii) Movement of Investment Fluctuation Reserve</b>		
a) Opening Balance	4.65	2.45
b) Add : Amount Transferred during the Year	1.95	2.20
c) Less : Drawdown	0.00	
d) Closing Balance	6.60	4.65
iii) Closing Balance in IFR as a Percentage of Closing Balance of Investments in AFS and HFT/Current Category	5.66%	4.66%

## Annexure – 6 Sale and transfers to/from HTM category during the Current FY 2023-24

Sr. No.	Date	Description	Face Value	Book Value
1	03-04-2023	GOI 6.64% 2035	5.00	4.72
2				
3				

## Annexure – 7 NON-SLR INVESTMENT PORTFOLIO:

### i. Non-Performing Non-SLR Investments

(Amt.in Crore)

Sr. No.	Particulars	Current FY 2023-24	Previous FY 2022-23
a)	Opening Balance	0.00	0.00
b)	Additions during the Year since 1st April	0.00	0.00
c)	Reduction during the Year	0.00	0.00
d)	Closing Balance	0.00	0.00
e)	Total Provision Held	0.00	0.00

### ii. Issuer composition of Non-SLR Investments

(Amt. in Crore)

Sr. No.	Issuer	Amount		Extent of PVT Placement		Extent of Below Invest Grade Securities		Extent of Unrated Securities		Extent of Unlisted Securities	
		Mar-24	Mar-23	Mar-24	Mar-23	Mar-24	Mar-23	Mar-24	Mar-23	Mar-24	Mar-23
a)	PSUs	0.00	0.00	0.00	0.00	0.00	0.00	0.00	0.00	0.00	0.00
b)	FIs	0.00	0.00	0.00	0.00	0.00	0.00	0.00	0.00	0.00	0.00
c)	Banks	0.00	0.00	0.00	0.00	0.00	0.00	0.00	0.00	0.00	0.00
d)	Pvt Corporates	0.00	0.00	0.00	0.00	0.00	0.00	0.00	0.00	0.00	0.00
e)	Subsidiaries/ Joint Ventures										
f)	Others	7.63	12.52	0.00	0.00	0.00	0.00	0.00	0.00	0.00	0.00
g)	Provision Held Towards Depreciation	0.00	0.00	0.00	0.00	0.00	0.00	0.00	0.00	0.00	0.00
	<b>Total</b>	7.63	12.52	0.00	0.00	0.00	0.00	0.00	0.00	0.00	0.00

# THE BARODA CITY CO-OPERATIVE BANK LTD - VADODARA

## Annexure – 8 ASSET QUALITY :

### i. Classification of Advances and Provisions Held : as on 31-03-2024

(Amt. in Crore)

	Standard	Non-Performing			Total NPA	Total Advances
	Total Standard Advances	Sub-Standard	Doubtful	Loss		
Gross Standard Advances and NPAs	152.89	1.32	4.41	1.60	7.33	160.22
Opening Balance <b>01-04-2023</b>	152.89	1.32	4.41	1.60	7.33	160.22
Add: Addition During the Year	65.08	1.44	-	-	1.44	66.52
Less: Reductions during the Year	51.98	2.60	0.62	0.11	3.33	55.31
Closing Balance <b>31-03-2024</b>	165.99	0.16	3.79	1.49	5.44	171.43
* Reductions in Gross NPAs due to:	-	-	-	-	-	-
i) Upgradation	-	-	-	-	-	-
ii) Recoveries (Excluding Upgradation)	-	2.60	0.62	0.11	3.33	3.33
iii) Technical/Prudential Write-offs	-	-	-	-	-	-
iv) Write-offs other than under (iii)	-	-	-	-	-	-
Provisions (Excluding Floating Provisions)	-	-	-	-	-	-
Opening Balance <b>01-04-2023</b>	0.63	0.13	3.59	1.60	5.32	5.95
Add: Fresh Provisions made during Year	0.05	-	-	-	-	0.05
Less : Excess Provision reversed/Write-off loans	-	0.11	0.02	0.11	0.24	0.24
Closing Balance of Provision held <b>31-03-2024</b>	0.68	0.02	3.57	1.49	5.08	5.76
Net NPAs	-	-	-	-	-	-
Opening Balance <b>01-04-2023</b>	-	-	-	-	-	-
Add: Fresh additions during Year	-	-	-	-	-	-
Less : Reduction during year	-	-	-	-	-	-
Closing Balance <b>31-03-2024</b>	-	-	-	-	-	-
Floating Provisions	-	-	-	-	-	-
Opening Balance <b>01-04-2023</b>	0.22	-	-	-	9.15	9.37
Add: Additional provisions made during Year	-	-	-	-	1.82	1.82
Less : Amount drawn down during year	0.05	-	-	-	-	0.05
Closing Balance of Floating Provision held	0.17	-	-	-	10.97	11.14
Technical Writ-offs and recoveries made thereon	-	-	-	-	-	-
Opening Balance of Tech/Prudential Written-off A/Cs	-	-	-	-	-	-
Add: Tech/Prudential Written-offs during year	-	-	-	-	-	-
Less: Recoveries made from Previously Tech /Prudential Written-off A/Cs during year	-	-	-	-	-	-
Closing Balance	-	-	-	-	-	-

# THE BARODA CITY CO-OPERATIVE BANK LTD - VADODARA

## ii. Classification of Advances and Provisions Held: as on 31-03-2023

(Amt. in Crore)

	Standard	Non-Performing			Total NPA	Total Advances
	Total Standard Advances	Sub-Standard	Doubtful	Loss		
Gross Standard Advances and NPAs	130.81	1.78	6.99	1.96	10.73	141.54
Opening Balance <b>01-04-2022</b>	130.81	1.78	6.99	1.96	10.73	141.54
Add: Addition During the Year	77.97	3.82	-	-	3.82	81.79
Less: Reductions during the Year	55.89	4.28	2.58	0.36	7.22	63.11
Closing Balance <b>31-03-2023</b>	152.89	1.32	4.41	1.60	7.33	160.22
* Reductions in Gross NPAs due to:	-	-	-	-	-	-
i) Upgradation	-	-	-	-	-	-
ii) Recoveries (Excluding Upgradation)	-	4.28	2.58	0.36	7.22	7.22
iii) Technical/Prudential Write-offs	-	-	-	-	-	-
iv) Write-offs other than under (iii)	-	-	-	-	-	-
	-	-	-	-	-	-
Provisions (Excluding Floating Provisions)	-	-	-	-	-	-
Opening Balance <b>01-04-2022</b>	0.61	0.18	5.79	1.96	7.93	8.54
Add: Fresh Provisions made during Year	0.02	-	-	-	-	0.02
Less : Excess Provision reversed/Write-off loans	-	0.05	2.20	0.36	2.61	2.61
Closing Balance of Provision held <b>31-03-2023</b>	0.63	0.13	3.59	1.60	5.32	5.95
	-	-	-	-	-	-
Net NPAs	-	-	-	-	-	-
Opening Balance	-	-	-	-	-	-
Add: Fresh additions during Year	-	-	-	-	-	-
Less : Reduction during year	-	-	-	-	-	-
Closing Balance	-	-	-	-	-	-
	-	-	-	-	-	-
Floating Provisions	-	-	-	-	-	-
Opening Balance	0.14	-	-	-	6.86	7.00
Add: Additional provisions made during Year	0.08	-	-	-	2.29	2.37
Less : Amount drawn down during year	-	-	-	-	-	-
Closing Balance of Floating Provision held	0.22	0.00	0.00	0.00	9.15	9.37
	-	-	-	-	-	-
Technical Writ-offs and recoveries made thereon	-	-	-	-	-	-
Opening Balance of Tech/Prudential Written-off A/Cs	-	-	-	-	-	-
Add: Tech/Prudential Written-offs during year	-	-	-	-	-	-
Less: Recoveries made from Previously Tech/Prudential Written-off A/Cs during year	-	-	-	-	-	-
Closing Balance	-	-	-	-	-	-

# THE BARODA CITY CO-OPERATIVE BANK LTD - VADODARA

## Annexure – 9 Sector-wise Advances and Gross NPAs:

(Amt. in Crore)

Sr.No.	Sector	Current FY 2023-24			Previous FY 2022-23		
		Outstanding Total Advances	Gross NPAs	% of Gross NPAs to Total Advances in that Sector	Outstanding Total Advances	Gross NPAs	% of Gross NPAs to Total Advances in that Sector
<b>i)</b>	<b>Priority Sector</b>						
a)	Agriculture and Allies Activities	-	-	-	-	-	-
b)	Advances to industries eligible as priority Sector lending	50.14	2.07	1.21	38.92	2.89	1.80
c)	Services	27.83	0.64	0.37	26.32	1.04	0.65
d)	Personal Loans	19.59	0.10	0.06	21.71	0.22	0.14
	<b>Sub-Total (i)</b>	<b>97.56</b>	<b>2.81</b>	<b>1.64</b>	<b>86.95</b>	<b>4.15</b>	<b>2.59</b>
<b>ii)</b>	<b>Non-Priority Sector</b>						
a)	Agriculture and Allies Activities	-	-	-	-	-	-
b)	Industry	0.54	0.00	0.00	0.87	0.00	0.00
c)	Services	4.85	0.00	0.00	18.43	0.00	0.00
d)	Personal Loans	68.48	2.63	1.53	53.97	3.18	1.98
	<b>Sub-Total (ii)</b>	<b>73.87</b>	<b>2.63</b>	<b>1.53</b>	<b>73.27</b>	<b>3.18</b>	<b>1.98</b>
	<b>Total (i+ii)</b>	<b>171.43</b>	<b>5.44</b>	<b>3.17</b>	<b>160.22</b>	<b>7.33</b>	<b>4.57</b>

## Annexure – 10 DISCLOSURES UNDER RESOLUTION FRAMWORK FOR COVID-19 RELATED STRESS

### i. Disclosures to be made half year Ending September 30, 2023

(Amt.in Crore)

Type of Borrower	Exposure to accounts classified as Standard Consequent to implementation of resolution plan-position as at the end of the previous half year (A)	of (A), aggregate debt that slipped into NPA during the half year	of (A) amount written off during the held year	of (A) amount paid by the borrowers during the half year	Exposure to accounts classified as Standard Consequent to implementation of resolution plan-position as at the end of the this half year
Personal Loans	5.97	0.38	0.00	0.41	4.98
Corporate Persons	2.60	0.00	0.00	0.48	1.86
of Which MSMEs	2.60	0.00	0.00	0.48	1.86
Others	0.00	0.00	0.00	0.00	0.00
<b>Total</b>	<b>8.57</b>	<b>0.38</b>	<b>0.00</b>	<b>0.89</b>	<b>6.84</b>

# THE BARODA CITY CO-OPERATIVE BANK LTD - VADODARA

ii. Disclosures to be made half year Ending March 31, 2024

(Amt.in Crore)

Type of Borrower	Exposure to accounts classified as Standard Consequent to implementation of resolution plan-position as at the end of the previous half year (A)	of (A), aggregate debt that slipped into NPA during the half year	of (A) amount written off during the held year	of (A) amount paid by the borrowers during the half year	Exposure to accounts classified as Standard Consequent to implementation of resolution plan-position as at the end of the this half year
Personal Loans	4.98	0.00	0.00	0.41	4.72
Corporate Persons	1.86	0.00	0.00	0.26	1.23
of Which MSMEs	1.86	0.00	0.00	0.26	1.23
Others	0.00	0.00	0.00	0.00	0.00
<b>Total</b>	<b>6.84</b>	<b>0.00</b>	<b>0.00</b>	<b>0.67</b>	<b>5.95</b>

## Annexure – 11 Exposure to Real Estate Sector:

(Amt. in Crore)

Category	Current FY 2023-24	Previous FY 2022-23
i) Direct Exposure		
a) Residential Mortgages Lending fully Secured by Mortgages on residential property that is or will be occupied by the borrower or that is rented. Individual housing loans eligible for inclusion in priority sector advances shall be shown separately. Exposure would also include non-fund based (NFB) limits.	22.83	20.06
b) Commercial Real Estate - Lending secured by Mortgages on commercial real estate (office buildings, retail space, multipurpose commercial premises, multifamily residential buildings, multi tenanted commercial premises, industrial or warehouse space, hotels, land acquisition, development and constructions, etc.). Exposure would be also non-fund based (NFB) limits;	33.08	33.91
c) Indirect Exposure Fund based and non-fund based exposures on National Housing Bank and housing Finance Companies.	0.00	0.00
<b>Total Exposure to Real Estate Sector</b>	<b>55.91</b>	<b>53.97</b>

## Annexure – 12 Unsecured advances

(Amt. in Crore)

Particulars	Current FY 2023-24	Previous FY 2022-23
Total unsecured advances of the bank	0.63	0.95
Out of the above, amount of advances for which intangible securities such as charge over the rights, licenses, authority, etc. have been taken	-	-
Estimated value of such intangible securities	NIL	NIL

# THE BARODA CITY CO-OPERATIVE BANK LTD - VADODARA

## Annexure – 13 CONCENTRATION OF DEPOSITS, ADVANCES, EXPOSURES AND NPAS:

### a) Concentration of deposits

(Amt.in Crore)

Particulars	Current FY 2023-24	Previous FY 2022-23
Total deposits of the twenty largest depositors	122.95	109.06
Percentage of deposits of twenty largest depositors to total deposits of the bank	36.54%	34.07%

### b) Concentration of advances

Particulars	Current FY 2023-24	Previous FY 2022-23
Total advances to the twenty largest borrowers	34.69	32.15
Percentage of advances to twenty largest borrowers to total advances of the bank	20.24%	20.06%

### c) Concentration of exposures

Particulars	Current FY 2023-24	Previous FY 2022-23
Total exposure to the twenty largest borrowers/customers	4.03	6.50
Percentage of exposures to the twenty largest borrowers/customers to the total exposure of the bank on borrowers/customers	2.35%	4.06%

### d) Concentration of NPAs

Particulars	Current FY 2023-24	Previous FY 2022-23
Total Exposure to the top twenty NPA accounts	4.52	5.86
Percentage of exposures to the twenty largest NPA exposure to total Gross NPAs.	83.09%	79.94%

## Annexure – 14 Transfers to Depositor Education and Awareness Fund (DEA Fund)

Sr. No.	Particulars	Current FY 2023-24	Previous FY 2022-23
i)	Opening balance of amounts transferred to DEA Fund	2.84	2.55
ii)	Add: Amounts transferred to DEA Fund during the year	0.12	0.39
iii)	Less: Amounts reimbursed by DEA Fund towards claims	0.26	0.10
iv)	Closing balance of amounts transferred to DEA Fund	2.70	2.84

## Annexure – 15 Disclosures of Complaints

### a) Summary information on complaints received by the bank from customers and from the Offices of Banking Ombudsman (OBOs)

Sr. No	Particulars	Current FY 2023-24	Previous FY 2022-23
Complaints received by the bank from its customers			
1.	Number of complaints pending at beginning of the year	0	0
2.	Number of complaints received during the year	0	2
3.	Number of complaints disposed during the year	0	2
3.1	Of which, number of complaints rejected by the bank	0	0
4.	Number of complaints pending at the end of the year	0	0
Maintainable complaints received by the bank from OBOs		0	0

## THE BARODA CITY CO-OPERATIVE BANK LTD - VADODARA

5.		Number of maintainable complaints received by the bank from OBOs		
	5.1.	Of 5, number of complaints resolved in favour of the bank by BOs		
	5.2	Of 5, number of complaints resolved through conciliation/mediation/advisories issued by BOs		
	5.3	Of 5, number of complaints resolved after passing of Awards by BOs against the bank		
6.		Number of Awards unimplemented within the stipulated time (other than those appealed)		

### b) Top five grounds<sup>32</sup> of Complaints received by the bank from customers

Grounds of complaints, (i.e. complaints relating to)	Number of complaints pending at the beginning of the year	Number of complaints received during the year	% increase/ decrease in the number of complaints received over the previous year	Number of complaints pending at the end of the year	Of 5, number of complaints pending beyond 30 days
1	2	3	4	5	6
<b>Current FY 2023-24</b>					
Ground - 1					
Ground - 2					
Ground - 3					
Ground - 4					
Ground - 5					
Others					
<b>Total</b>					
<b>Previous FY 2022-23</b>					
Ground - 1					
Ground - 2					
Ground - 3					
Ground - 4					
Ground - 5					
Others					
<b>Total</b>					

### Annexure – 16 Disclosures on Remuneration:

(Amount in ₹ crore)

Sr No.	Nature of Transaction	Current FY 2023-24	Previous FY 2022-23
1	Remuneration to Key management personnel Shri Satyenbhai S Patel	0.12	0.0216 Shri J M Bhatt
2	Director's Sitting Fees	0.0049	0.0037

### Annexure – 17 Business Ratios

Particular	Current FY 2023-24	Previous FY 2022-23
i) Interest Income as a percentage to Working Funds	7.00%	7.14%
ii) Non-interest income as a percentage to Working Funds	0.53%	1.07%

## THE BARODA CITY CO-OPERATIVE BANK LTD - VADODARA

iii) Cost of Deposits	4.93%	4.58%
iv) Net Interest Margin	9.87%	5.26%
v) Operating Profit as a percentage to Working Funds	1.77%	2.54%
vi) Return on Assets	0.80%	0.92%
vii) Business (deposits plus advances) per employees (in ₹crore)	7.26	6.58
viii) Profit per employee (in ₹ crore)	0.0507	0.0513

### Annexure – 18 Provisions and contingencies

Provision debited to Profit and Loss Account	Current FY 2023-24	Previous FY 2022-23
i) Provisions for NPI	0.00	0.00
ii) Provision towards NPA	0.74	0.62
iii) Provision made towards Income tax	1.14	1.25
iv) Other Provisions and Contingencies (with details)		
a) Provision Special Reserve	1.27	1.38
b) Provision Shatabdi Mahotsav Fund	0.50	1.50
c) Provision Investment Fluctuation Reserve	0.00	1.00
d) Provision G.sec (HTM) Amortisation	0.00	0.01
e) Provision Share Holder Gift	0.00	0.50
f) Provision Depreciation On Investment	0.00	0.49
g) Provision for Cyber Security Fund	0.30	0.00

### Annexure – 19 Payment of DICGC Insurance Premium

Sr. No.	Particulars	Current FY 2023-24	Previous FY 2022-23
i)	Payment of DICGC Insurance Premium	0.43	0.42
ii)	Arrears in payment of DICGC premium	0.00	0.00

### Annexure – 20 Advances to directors & their relatives, companies / firms in which they are interested: (Amt. in Crore)

	Particulars	Amount
1.	Fund –based (Against bank’s own deposits)	3.52
2.	Non-fund based (Guarantees, L/C, etc.)	0.00
	<b>Total:-</b>	<b>3.52</b>

### Annexure – 21 CASH FLOW STATEMENT:

(Amt. in Crore)

PARTICULARS	Direct Method
<b>A. CASH FLOW FROM OPERATING ACTIVITIES</b>	
Increase/(Decrease) in Net Profit	(1986038.22)
Increase/(Decrease) in Deposits	163815798.14
(Increase)/Decrease in Advances	(112143448.00)
(Increase)/Decrease in Investment	9912073.67
Increase/(Decrease) in Branch Adjustment	0.00
Increase/(Decrease) in Reserves & Surplus	42694180.38
(Increase)/Decrease in Interest Receivable	(6087121.33)
Increase/(Decrease) in Interest Payable	846714.00



## THE BARODA CITY CO-OPERATIVE BANK LTD - VADODARA

(Increase)/Decrease in Other Assets		(20938485.65)
Increase/(Decrease) in Other Liabilities/Provisions		(19208612.24)
<b>Net Cash Flow from Operating Activities (A)</b>		<b>56905060.75</b>
<b>B. CASH FLOW FROM INVESTING ACTIVITIES</b>		
(Increase)/Decrease in Land & Building		520195.10
(Increase)/Decrease in Revaluation of Fixed Assets		8089050.00
(Increase)/Decrease in Fixed Assets		(1149857.30)
<b>Cash Flow from Investing Activities (B)</b>		<b>7459387.80</b>
<b>C. CASH FLOW FROM FINANCING ACTIVITIES</b>		
Increase/(Decrease) in Share Capital		2386530.00
Increase/(Decrease) in Borrowings		0.00
<b>Cash Flow from Financing Activities (C)</b>		<b>2386530.00</b>
<b>NET INCREASE IN CASH &amp; EQUIVALENTS (A + B + C)</b>		<b>66750978.55</b>
<b>Opening Balance of Cash &amp; Cash Equivalent</b>		<b>631903004.97</b>
<b>Closing Balance of Cash &amp; Cash Equivalent</b>		<b>698653983.52</b>
<b>NET INCREASE / (DECREASE) in CASH &amp; CASH EQUIVALENTS</b>		<b>66750978.55</b>

### Other Disclosures and Notes on Accounts:

1. Fees and Brokerage Earned in Banc assurance business Marketing and distribution –Rs. 0.06 Crores
2. The Bank had not sold and purchased any PLCs during the FY 2023-24
3. The RBI has not imposed any penalty on the Bank in the F.Y. 2023-24
4. Previous year figures are regrouped where ever necessary.
5. The Bank has no exposure to Capital Market.
6. The Bank has not restructured any advances account during F.Y. 2023-24
7. The Bank has achieved the overall exposure of advances to Priority Sector & Weaker Sector as per RBI guidelines.
8. Number of Nominal members 116 are as per RBI guidelines.
9. During the year transaction in foreign currency is Nil.
10. Bank has fully implemented the percentage of Share Linkage on Advances as per RBI guidelines.
11. Compliance with Accounting Standards:
  - a. The Bank is primarily engaged in banking activity as defined by RBI. As interest income accounts for more than 90.13 % of banks total revenue, separate business segment reporting as per AS-17 is not considered necessary.
  - b. Earnings per share for the year 2023–24 is Rs. 7.24.
  - c. The Bank has provided fully Liability for Leave Encashment for the financial year 2023-24. Total provision of Rs. 2.45 Crore for Leave Encashment Liabilities has been made by the Bank up to financial year ending on 31.03.2024
  - d. The business of the Bank is divided into two segments i.e. Treasury and Banking Operation. The Banking Operations have not been further classified into Wholesale and Retail Banking since the operations from retail is less than the prescribed norms.
12. The bank has received rupees 1 crore against part payment of fixed deposit held with The Madhavpura Mercantile Co Op Bank Ltd. The said amount is credited to profit and loss account, which was fully provided in earlier years.

### SIGNIFICANT ACCOUNTING POLICIES

#### 1. Accounting Conventions:

The accompanying financial statements have been prepared on historical cost convention & on Going Concern basis and confirm to the statutory provisions and practices prevailing in India, unless otherwise stated.

# THE BARODA CITY CO-OPERATIVE BANK LTD - VADODARA

## 2. Revenue Recognition:

All revenues are accounted for an accrual basis. However, considering the nature of transactions, smallness of amounts, uncertainties involved as per RBI directives and consistent practice, Commission, Brokerage and Exchange and Interest and other income on Non-Performing Assets are recognized on Cash basis. In case of Locker Rent, bank has Practice to accept deposit from customers on which interest is paid on deposit & Locker Rent is charged from them.

## 3. Expenditure:

All Expenses except as otherwise stated are accounted for on accrual basis. (However, considering the nature of transactions, smallness of amounts, uncertainties involved and consistent practice) Certain expenses are booked on payment basis.

## 4. Staff Retirement Benefits:

- Provident fund: on actual basis
- Gratuity fund: The bank has arranged group gratuity fund with LIC. The premium has been charged to profit and loss account.
- Liability for Leave Encashment is accounted accrual basis.

## 5. Fixed Assets :

- Fixed Assets are stated at their historical cost less depreciation.
- Fixed Assets was Revalued and Reserve made as per RBI circular & Guideline.
- Depreciation is provided on Written down Value Method except Dep. on computer & software and Solar Systems (Purchased New) which is provided on straight-line method and rates of Depreciation are as under:
- Depreciation on Revalued assets is calculated & adjusted against revaluation reserve and not charged to P&L account amount to Rs. 80,89,050.00

Sr. No.	Fixed Assets	Rate of Depreciation
1	Building	05.00%
2	Safe Deposit Vault	05.00%
3	Vehicles	20.00%
4	Library Books	05.00%
5	Computer (Hardware & Software)	33.33%
6	Dead Stock, Furniture Fixture Etc.	15.00%
7	Solar Systems (Old)	40.00%
8	Solar Systems (New)	33.33%

## 6. Advances :

- Advances are classified into Performing & Non Performing Assets and provision is made based on Management assessment and as per RBI guidelines.
- Advances are stated at gross value while provision for performing & Non Performing Assets required to be made as per R.B.I. guidelines are shown under the head Reserve & Other Funds under subhead Bad & Doubtful Debts Reserve Fund, Special Reserve Fund in accordance with requirement of the applicable status for disclosure.

On Behalf of Board of Directors:

Shri Satyen S Patel (C.E.O)

For R N SHAH ASSOCIATES.

CHARTERED ACCOUNTANTS

FRN: 112511W

DATE: 30-05-2024

PLACE: VADODARA

CA KINTAN D. MOHITE

PARTNER

MRN: 131678

PENAL NO: 09

UDIN: 24131678BKEHIK8428

# THE BARODA CITY CO-OPERATIVE BANK LTD - VADODARA

SCHEDULE-1 (FUNDS)		31.03.2024 (RS.PS)	
1	<b>Reserve Fund Balance C/F</b> Add : 2022-2023 Profit Distribution Add : 2020-2021 Profit Distribution Add : 2021-2022 Profit Distribution Add : Nominal Fees	9,85,93,047.38 93,83,820.80 3,75,000.00 42,50,000.00 6,750.00	11,26,08,618.18
2	<b>Special Reserve Fund Balance C/F</b> Add : 2023-2024 Provision	4,42,53,716.32 1,27,22,072.90	5,69,75,789.22
3	<b>Building Fund C/F</b> Add : 2022-2023 Profit Allocation	1,79,53,552.16 17,36,609.77	1,96,90,161.93
4	<b>Education &amp; Medical Relief Fund Balance C/F</b> Add : 2022-2023 Profit Allocation	79,26,205.18 17,79,804.19	97,06,009.37
5	<b>Dividend Equalisation Fund Balance C/F</b> Add : 2022-2023 Profit Allocation	86,70,377.80 16,01,823.77	1,02,72,201.57
6	<b>Charity Fund Balance C/F</b> Add : 2022-2023 Profit Allocation	60,04,255.80 17,79,804.19	77,84,059.99
7	<b>Investment Fluctuation Reserve Balance C/F</b> Add : 2022-2023 Profit Allocation Add : Transfer From Investment Depreciation Reserve	4,64,52,994.51 35,00,000.00 1,60,96,301.30	6,60,49,295.81
8	<b>Investment Depreciation Reserve Balance C/F</b> Less - GOI Mark to Market Provision Add - Excess Balance of IDR 31.03.2023 Less -Transfer to Investment Fluctuation Reserve	1,62,60,680.00 6,58,250.00 4,93,871.30 1,60,96,301.30	0.00
9	<b>Provision for Staff Welfare Fund C/F</b>	73,327.45	73,327.45
10	<b>Provision for NPA Reserve Fund C/F</b> Add - NPA Provision Add : 2023-2024 Provision	13,23,72,414.85 20,00,000.00 54,06,880.98	13,97,79,295.83
11	<b>Contingent Provision for Standard Assets Fund C/F</b>	85,00,000.00	85,00,000.00
12	<b>Bad and Doubtful Debts Reserve Balance C/F</b> Add : 2022-2023 Profit Allocation Add : 2020-2021 Profit Allocation Add : 2021-2022 Profit Allocation	1,23,58,076.69 56,30,292.48 2,25,000.00 25,50,000.00	2,07,63,369.17
13	<b>Provision for NPA Investment Balance C/F</b> Less - Excess Provision Reverse BCCB Less - Excess Provision Reverse MNCB	10,41,78,218.00 250.00 10000000.00	9,41,77,968.00
14	<b>Satabdi Mahotsav Fund C/F</b> Add : From Current Year Profit	2,50,00,000.00 5000000.00	3,00,00,000.00
15	<b>Cyber Security Fund C/F</b> Add : Provision of Current Year	20,00,000.00 30,00,000.00	50,00,000.00
16	<b>Building Revaluation Reserve C/F</b> Less : 5% depreciation	16,17,81,000.00 80,89,050.00	15,36,91,950.00
Total			73,50,72,046.52

SCHEDULE-2 (DEPOSITS)		31.03.2024 (RS.PS)	
31.03.2023	Account Name	No of Accounts	31.03.2024 (RS.PS)
	<b>A Fixed Deposits</b>		
5,16,24,500.00	1 Savings Locker	2,103	1,51,77,960.00
6,06,81,264.95	2 Locker Security Deposit	6,442	13,88,30,304.39
7,21,07,964.00	3 Savifix Deposit	1,836	6,14,69,051.00
40,09,11,626.65	4 Fixed Deposits (L.T)	1,651	33,07,12,891.65
30,15,000.00	5 Fixed Deposit (L.T - Monthly)	18	11,10,000.00
4,57,70,604.00	6 Fixed Deposit (S.T)	366	3,13,99,121.00
91,07,79,672.74	7 Laxmi Deposits	5,035	63,80,10,155.74
60,96,44,621.00	8 Monthly Income Deposits	426	59,00,62,964.00
65,45,499.00	9 Recurring Deposits	233	62,38,902.00
22,95,22,665.00	10 Amrut Mahotsav Deposit New	1119	49,91,40,486.00
	11 Dhanvarsha Deposit	950	23,91,44,732.00
<b>2,39,06,03,417.34</b>	<b>Total</b>	<b>20,179</b>	<b>2,55,12,96,567.78</b>

cont.....


## THE BARODA CITY CO-OPERATIVE BANK LTD - VADODARA

31.03.2023	Account Name	No of Accounts	31.03.2024 (RS.PS)
	<b>B Saving Deposit</b>		
7,25,20,686.87	1 Sabhasad Saving Deposit	25054	7,79,91,855.85
57,31,69,490.95	2 Saving Deposit	22945	59,90,61,963.77
<b>64,56,90,177.82</b>	<b>Total</b>	<b>47,999</b>	<b>67,70,53,819.62</b>
	<b>C Current Deposit</b>		
11,68,63,746.10	1 Current Deposit	1539	11,19,67,274.39
4,77,62,660.23	2 Cash Credit (Credit Balance)	46	2,44,18,137.84
<b>16,46,26,406.33</b>	<b>Total</b>	<b>1,585</b>	<b>13,63,85,412.23</b>
<b>3,20,09,20,001.49</b>	<b>Total Deposits</b>	<b>69,763</b>	<b>3,36,47,35,799.63</b>




### SCHEDULE-3 (INVESTMENT IN GOVT. SEC)

31-03-2023 (RS.PS)	Description	31.03.2024 (RS.PS)
1,44,94,19,392.00	Face Value (Rs)	1,50,34,19,392.00
1,44,77,23,201.34	Purchase Value (Rs)	1,49,84,94,774.39
1,43,42,77,727.00	Market Value (Rs)	1,50,92,52,745.00
	<b>Book Value</b>	
62,01,42,768.39	Govt. Securities	73,86,92,736.39
0.00	Investment Redemption (Premium)	0.00
71,97,30,038.00	State Development Loan	75,98,02,038.00
9,96,33,100.00	GOI - Tbills	0.00
<b>1,43,95,05,906.39</b>	<b>Total</b>	<b>1,49,84,94,774.39</b>



### SCHEDULE-3(A) (INVESTMENT IN SHARES)

31-03-2023 (RS.PS)	Description	31.03.2024 (RS.PS)
300.00	1 The Vadodara Sahakari Land Mortgage Bank Ltd	300.00
250.00	2 Baroda Cent. Co.Op. Bank Ltd.	2,500.00
30,000.00	3 Guj. State Co-Op. Bank Ltd.	30,000.00
<b>30,550.00</b>	<b>Total</b>	<b>32,800.00</b>



### SCHEDULE-3(B) (INVESTMENT IN MUTUALFUND)

31-03-2023 (RS.PS)	Description	31.03.2024 (RS.PS)
1,49,99,250.04	1 Aditya Brila Sunlife Regular Saving Fund	1,49,99,250.04
2,00,56,295.41	2 Axis Ultra Short Term Fund - Direct Growth	2,00,56,295.41
2,00,38,889.78	3 SBI Overnight Fund	0.00
2,00,38,889.78	4 ICICI Prudential Overnight Fund Growth	0.00
2,49,98,749.72	5 Kotak Overnight Fund Growth	0.00
2,49,98,750.06	6 Tata Overnight Fund- Growth	0.00
-	7 ICICI Prudential Ultra Short Term Fund - Growth	2,11,72,087.67
<b>12,51,30,824.79</b>	<b>Total</b>	<b>5,62,27,633.12</b>



### SCHEDULE-3(C) (INVESTMENT IN PSU)

31-03-2023 (RS.PS)	Description	31.03.2024 (RS.PS)
99,97,000.00	1 7.65% Tata Capital Financial Service Limited 2032	99,97,000.00
1,00,08,000.00	2 8% HDFC Ltd 2032	1,00,08,000.00
<b>2,00,05,000.00</b>	<b>Total</b>	<b>2,00,05,000.00</b>

# THE BARODA CITY CO-OPERATIVE BANK LTD - VADODARA

<b>SCHEDULE- 4 (ADVANCES)</b>			
31-03-2023 (RS.PS)	Description		31.03.2024 (RS.PS)
	<b>Short Term Loan</b>		
	<b>Secured Loan</b>		
6,70,22,740.30	1 Gold Loan	563	6,94,63,812.51
9,60,956.00	2 Staff Festival Loan	42	9,91,349.00
23,18,91,527.89	3 Cash Credit	73	25,69,30,925.23
4,21,25,598.21	4 Fixed Deposit Cash Credit	70	5,36,90,534.23
5,85,45,587.29	5 Hypothecation Cash Credit (Short Term Un-secured)	20	5,41,17,485.25
3,56,905.83	1 Over Draft	8	4,10,976.00
<b>40,09,03,315.52</b>	<b>TOTAL</b>	<b>776</b>	<b>43,56,05,082.22</b>
	<b>Medium Term Loan</b>		
	<b>Secured Loan</b>		
20,84,407.00	1 Surety Loan Staff	20	14,51,841.00
62,20,88,982.41	2 Hire Purchase Loan	693	61,58,26,163.95
49,42,384.00	3 Hire Purchase Loan (Staff)	24	39,60,830.00
43,35,612.76	4 Individual Hire Purchase Loan	8	12,74,874.76
23,94,653.00	5 Fixed Deposit Loan	20	37,65,046.00
1,41,37,216.00	6 Laxmi Deposit Loan	113	3,88,55,278.00
1,30,379.00	7 Bajpayee Swarojgar Loan	2	1,30,379.00
8,78,23,069.07	8 Term Loan	26	7,55,70,620.52
46,618.00	9 Staff Welfare Loan	2	65,028.00
4,98,60,447.24	10 Gold Term Loan	224	6,92,43,708.56
25,01,067.81	11 Atma Nirbhar Loan -2	0	0.00
1,88,06,476.00	12 Term Loan Floating	11	4,39,25,518.00
	<b>Un-Secured Loan</b>		0.00
25,58,663.99	1 Surety Loan	60	28,53,806.11
42,60,374.99	2 Individual Personal Loan	119	30,59,990.81
23,62,827.06	3 Atma Nirbhar Loan	0	0.00
<b>81,83,33,178.33</b>	<b>TOTAL</b>	<b>1,322</b>	<b>85,99,83,084.71</b>
	<b>Long Term Loan</b>		
	<b>Secured Loan</b>		
2,57,94,725.14	1 Education Loan	20	2,07,60,288.58
5,14,50,425.47	2 Loan Against Property	36	4,15,51,682.43
11,95,28,200.87	3 Housing Loan (New)	84	9,76,96,869.91
49,02,941.00	4 Housing Loan (Staff)	9	84,25,981.00
7,61,52,447.80	5 Housing Loan (Floating)	51	12,37,69,509.28
6,27,36,432.00	6 Loan Against Property (Floating)	39	7,23,13,382.00
4,23,79,277.00	7 Education Loan (Floating)	32	5,42,18,511.00
<b>38,29,44,449.28</b>	<b>TOTAL</b>	<b>271</b>	<b>41,87,36,224.20</b>
<b>1,60,21,80,943.13</b>	<b>TOTAL ADVANCES</b>	<b>2,369</b>	<b>1,71,43,24,391.13</b>

# THE BARODA CITY CO-OPERATIVE BANK LTD - VADODARA

<b>SCHEDULE- 5 ( OTHER EXPENSES )</b>			
31-03-2023 (RS.PS)	Description		31.03.2024 (RS.PS)
4,26,997.88	1 Branch Maintenance		3,83,712.07
74,876.90	2 Credit Report Charges Paid		47,847.46
5,71,625.17	3 Debit Card Fees Paid		2,82,942.65
5,27,421.02	4 Misc. Expense		3,43,908.93
3,02,682.36	5 Office Contingency		2,27,067.70
2,300.00	6 Building Repairing		8,148.22
0.00	7 Commission Paid		2,00,764.07
1,80,819.20	8 Commission IMPS/NEFT		39,548.21
42,636.00	9 Conveyance Expense		21,250.00
1,79,002.74	10 Vehicle Expense		1,66,965.36
450.00	11 GST Expenses		3,747.06
8,46,060.00	12 Professional Charges		9,62,696.68
32,17,171.28	13 Computer Expense		16,57,155.88
1,34,232.00	14 Provision Government Security (HTM) Amortisation		29,282.00
0.00	15 Locker Supplementary agreement		7,08,000.00
<b>65,06,274.55</b>	<b>TOTAL</b>		<b>50,83,036.29</b>
<b>SCHEDULE- 6 (PROVISIONS)</b>			
31-03-2023 (RS.PS)	Description		31.03.2024 (RS.PS)
61,77,280.44	1 Provision - NPA Loan		74,06,880.98
1,38,06,081.17	2 Provision - Special Reserve		1,27,22,072.90
1,25,11,761.06	3 Income tax Provision		1,14,21,862.60
2,00,00,000.00	4 Other Provisions And Funds		30,00,000.00
50,00,000.00	5 Share Holder Gift		50,00,000.00
48,60,000.00	6 Provision Depreciation on Investment		0.00
-	7 Provision for deferred tax liability		38,021.00
<b>6,23,55,122.67</b>	<b>TOTAL</b>		<b>3,95,88,837.48</b>
<b>SCHEDULE- 7 (OTHER INCOME)</b>			
31-03-2023 (RS.PS)	Description		31.03.2024 (RS.PS)
4,512.50	1 Dividend Income Received		4,517.50
4,000.34	2 Misc. Income		10,799.70
80,21,927.79	3 Incidental Charges Received		36,20,455.22
1,000.00	4 Recovery Charges Received		0.00
3,20,983.86	5 Processing Charges		3,82,650.09
	Processing Charges Loan	9,393.98	
	<b>ADD: Process Fees On Gold Loan</b>	2,55,871.11	
	<b>ADD: Inspection Charges Rec.</b>	1,17,385.00	
	<b>Total Processing Charges</b>	<b>3,82,650.09</b>	
17,83,828.00	6 Premium Rec/Paid On Sale Govt Sec		23,84,147.00
46,51,547.22	7 Safe Deposit Vault Rent Received		1,03,31,151.63
57,62,236.16	8 Mutual Fund Redemption A\C		22,38,628.76
4,65,892.28	9 Charges Received On Debit Card		2,88,635.17
2,800.00	10 Entry Fees		3,925.00
5,145.00	11 Transfer Fees		4,205.00
20,105.00	12 Form Fees		18,846.00
41,132.00	13 Building Valuations Fees		45,398.24
5,515.00	14 Share / Passbook Duplicate		1,860.00
1,08,734.00	15 Cheque Book Charges Received		1,09,775.50
3,21,682.00	16 Provision - Differed Tax		0.00
0.00	17 Profit/Loss On Sale Of Assets		287.00
2,00,00,000.00	18 Excess Provision Reverse		1,10,03,098.00
	For Baroda Central Co-op Bank Share	250.00	
	<b>ADD: For MNCB FD</b>	10000000.00	
	<b>ADD: For Staff Gratuity Paid</b>	1002848.00	
	<b>Total Excess Provision Reverse</b>	<b>1,10,03,098.00</b>	
	19 Income Tax Refund		14,38,187.00
<b>4,15,21,041.15</b>	<b>TOTAL</b>		<b>3,18,86,566.81</b>

ફિક્સડ એસેટ્સ ઘસારા નું (શીડયુલ - ૮)

અ નં	વિગત	દર	ગ્રોસ બ્લોક						ઘસારા નો બ્લોક				નેટ બ્લોક	
			31.03.2023 ની બાકી	ખરીદ		વર્ષ દરમ્યાન વેચાણ/ ડ્રા-સફર	કુલ બાકી 31.03.2024	કુલ બાકી 31.03.2024	ચાલુ વર્ષ નો ઘસારો	ચાલુ વર્ષ નો વેચાણ ઘસારો	કુલ ઘસારો 31.03.2024	31.03.2023 ની બાકી	31.03.2024 ની બાકી	
				વર્ષ દરમ્યાન 01.04.23 30.09.23	વર્ષ દરમ્યાન 01.10.23 31.03.24									
1	સ્થાવર સિધકત :	5.00	19827.10	0.00	5433.20	10701332.07	10701332.07	534589.00	0.00	534589.00	10686938.17	10166743.07		
2	ડેડ સ્ટોક (ફર્નિચર)	15.00	0.00	17151.00	1.00	2816956.22	2816956.22	421250.00	0.00	421250.00	2799806.22	2395706.22		
3	લોકર્સ તથા પુસ્તક	5.00	0.00	1000.00	0.00	7333852.82	7333852.82	366668.00	0.00	366668.00	7332852.82	6967184.82		
4	વાહન ખાતે	20.00	0.00	0.00	0.00	798574.20	798574.20	159715.00	0.00	159715.00	798574.20	638859.20		
5	કોમ્પ્યુટર	33.33	301110.00	228648.20	0.00	2537155.68	2537155.68	1514956.00	0.00	1514956.00	2007397.48	1022199.68		
6	સોલર એનર્જી	40.00	0.00	42560.00	0.00	575884.42	575884.42	317318.00	0.00	317318.00	533324.42	258566.42		

# ધી બરોડા સીટી કો-ઓપરેટીવ બેંક લી. વડોદરા.

બેંકના પેટા કાયદામાં સુધારો કરવા માટે આગામી મળનારી વાર્ષિક સાધારણ સભામાં જરૂરી પેટા નિયમો સુધારા માટે રજૂ કરવા બાબતે			
પેટા નિયમ	ક્રમ	હાલનો પેટા કાયદો	સુધારેલો પેટા કાયદો
૯	અ	<b>સામાન્ય સભાસદ (નોમીનલ સભાસદ) દાખલ કરવા સંબંધી</b>	
	૧	વડોદરા જીલ્લામાં રહેતો અઢાર (૧૮) વર્ષ કરતાં ઓછો નહીં તેટલી ઉંમરનો હરકોઈ યોગ્ય પુરુષ અગર સ્ત્રી તેમજ પેઢી કે પેઢીના ભાગીદારો, સંસ્થા કે સંસ્થાના પ્રતિનિધિઓને વખતો વખતના રીઝર્વ બેંકના ધારા ધોરણ મુજબ સામાન્ય સભાસદ તરીકે દાખલ કરવામાં આવશે.	વડોદરા જીલ્લામાં તેમજ તેના સંલગ્ન જીલ્લાઓ જેવા કે પંચમહાલ, આણંદ, છોટાઉદેપુર, ભરૂચ, નર્મદા વિગેરેમાં રહેતો અઢાર (૧૮) વર્ષ કરતાં ઓછો નહીં તેટલી ઉંમરનો હરકોઈ યોગ્ય પુરુષ અગર સ્ત્રી તેમજ પેઢી કે પેઢીના ભાગીદારો, સંસ્થા કે સંસ્થાના પ્રતિનિધિઓને વખતો વખતના રીઝર્વ બેંકના ધારા ધોરણ મુજબ સામાન્ય સભાસદ તરીકે દાખલ કરવામાં આવશે.
		<b>નવીન ઉમેરો:-</b>	
૧૭	૮		સભાસદ બચત નીયમોમાં તથા વ્યાજના દરોમાં ફેરફાર કરવાનો અધિકાર વ્યવસ્થાપક મંડળને રહેશે.
૨૨		રીઝર્વ બેંક તરફથી વખતો વખત સુચવવામાં આવે તે નિયમોને આધિન રહીને સુચવવામાં આવે તે દર સુધી સેવિંગ્સ ખાતામાં વ્યાજ આપવામાં આવશે. પરંતુ જે માસમાં જે રકમ ઉપાડી હશે તે ઉપાડેલી રકમનું વ્યાજ આપવામાં આવશે નહીં.	રીઝર્વ બેંક તરફથી વખતો વખત સુચવવામાં આવે તે નિયમોને આધિન રહીને સેવિંગ્સ ખાતામાં દૈનિક વ્યાજનો દર આપવામાં આવશે.
૨૭		<b>કરજની યત્તા:-</b>	
		<b>રદ કરવી:-</b>	
	૨	સભાસદ બચતના ૭૫% સુધી.	રદ કરેલ છે.
	૪	માન્ય કરેલા શેર ઉપર, શેરના બજાર ભાવના ૬૦% સુધી	રદ કરેલ છે.
૩૮		<b>નવું મકાન બાંધવા માટેની લોન બાબત:-</b>	
	૧	કોઈપણ સભાસદને નવીન મકાન બાંધવા માટે રૂ.૭૦,૦૦,૦૦૦.૦૦ અંકે રૂપિયા સીતરે લાભ તથા રીઝર્વ બેંકના નીયમો મુજબ લોન આપી શકાશે અને તે રકમ મકાન ની કીમતના તથા યોજેલ બાંધકામની કીમતના ૮૦% સુધીની રહેશે.	કોઈપણ સભાસદને નવીન મકાન બાંધવા માટે રૂ.૧,૪૦,૦૦,૦૦૦.૦૦ અંકે રૂપિયા એક કરોડ ચાલીસ લાખ તથા રીઝર્વ બેંકના વખતો વખતના નીયમો મુજબ લોન આપી શકાશે અને તે રકમ મકાન ની કીમતના તથા યોજેલ બાંધકામની કીમતના ૮૦% સુધીની રહેશે.
	૨	સદર લોનની ભરપાઈ માટે વધારેમાં વધારે ૨૦ (વીસ) વર્ષ સુધી તથા વ્યવસ્થાપક મંડળ ઠરાવે તે મુજબ, માસિક હપ્તા કરી આપવામાં આવશે.	સદર લોનની ભરપાઈ માટે વધારેમાં વધારે ૨૦ (વીસ) વર્ષ સુધી તથા વ્યવસ્થાપક મંડળ ઠરાવે તે મુજબ, માસિક હપ્તા વધારી આપવામાં આવશે તથા ફ્લોટીંગ દરમાં વધારા ઘટાડાને ધ્યાનમાં રાખીને ધીરાણની ભરપાઈ માટે વર્ષમાં વધ ઘટની સત્તા વ્યવસ્થાપક મંડળની રહેશે.
૪૦		<b>વ્યાજના દર બાબત:-</b>	
	૨	ઠરાવી આપેલા હપ્તા મુદતમાં ન ભરે તો ચઢેલા હપ્તાની રકમ ઉપર નીચે પ્રમાણે ચાલુ વ્યાજ ઉપરાંત દંડનીય વ્યાજ વધુ લેવામાં આવશે.	ઠરાવી આપેલા હપ્તા મુદતમાં ન ભરે તો ચઢેલા હપ્તાની રકમ ઉપર નીચે પ્રમાણે ચાલુ વ્યાજ ઉપરાંત દંડનીય ચાર્જ વધુ લેવામાં આવશે.
	(૧)	પ્રથમના ભાર હપ્તા માટે ૧% પ્રમાણે	(૧) ઓવરડયું થયેથી ૨% પ્રમાણે
	(૨)	૧૨ હપ્તાથી વધુ હપ્તા પડ્યા હોય તો ૨% પ્રમાણે	(૨) ઓવરડયું થયેથી ૨% પ્રમાણે
	(૩)	તે જ પ્રમાણે કેશકેડીટ, ઓવરડ્રાફ્ટમાં જે અનરીન્યુ ખાતા હોય તેમાં પહેલા વર્ષ માટે ૧% અને બીજા વર્ષ થી ૨% દંડનીય વ્યાજ ચાલુ વ્યાજ ઉપરાંત લેવામાં આવશે.	(૩) તે જ પ્રમાણે કેશકેડીટ, ઓવરડ્રાફ્ટમાં જે અનરીન્યુ ખાતા હોય તેમાં ૨% દંડનીય ચાર્જ ચાલુ વ્યાજ ઉપરાંત લેવામાં આવશે.
		<b>ટીપ:-</b>	
		હપ્તાની તહકુબી જેમને આપવામાં આવી હશે તેમની પાસેથી તહકુબી આપેલા હપ્તાનું કલમ ૪૦ (૨) પ્રમાણે વધારાનું વ્યાજ લેવામાં આવશે નહીં.	હપ્તાની તહકુબી જેમને આપવામાં આવી હશે તેમની પાસેથી તહકુબી આપેલા હપ્તાનું કલમ ૪૦ (૨) પ્રમાણે ૨% દંડનીય ચાર્જ લેવામાં આવશે.
૭૫	૧૪	ચીફ એક્ઝિક્યુટીવ ઓફીસર, પગારદાર મેનેજીંગ ડીરેક્ટર, મેનેજરની નિયુકીત, ભરતરફી, રાજીનામું સહકારી મંડળીઓના રજીસ્ટ્રારશ્રીની પુર્વ મંજૂરી મેળવ્યા પછી વ્યવસ્થાપક સમિતી કરશે.	ચીફ એક્ઝિક્યુટીવ ઓફીસર, પગારદાર મેનેજીંગ ડીરેક્ટર, નિયુકીત, ભરતરફી, રાજીનામું રીઝર્વ બેંક ઓફ ઈન્ડિયાની પુર્વ મંજૂરી મેળવ્યા પછી વ્યવસ્થાપક સમિતી કરશે.
		<b>નવીન ઉમેરો:-</b>	
	૧૫		બેંકના ઉચ્ચ અધિકારીઓને વ્યવસ્થાપક મંડળ ઠરાવ કરીને કોઈ પણ બેંકમાં ફાયનાન્સીયલ કંપની, રીઝર્વ બેંક ઓફ ઈન્ડિયા, કલીયરીંગ કોર્પોરેશન ઓફ ઈન્ડિયામાં કરંટ એકાઉન્ટ ખોલાવી શકશે તેમજ બંધ કરી શકશે, લેવડ દેવડ માટે અધિકારીઓને બદલવા તથા કરજ (Borrowing) લેવું, બેંકની ફીક્સ ડીપોઝીટ, ગર્વનમેન્ટ સીક્યોરીટી, મ્યુચ્યુઅલ ફંડ, બોન્ડ ઉપર કેશકેડીટ, કરજ (Borrowing) લઈ શકશે તેમજ બંધ કરી શકશે.
૮૫	૧	બેંકના વ્યવસ્થાપક મંડળ તરફથી જે તે વખતે ઠરાવ કરીને જેમને અધિકાર આપવામાં આવે તે અમલદારો પૈકી ગમે તે બે જણાની સહીથી બેંકના ખાતાઓનો વહીવટ કરી શકશે અને લોન તથા બેંકના વેચાણના એન્ડોર્સમેન્ટ બેંક તરફથી કરી શકશે. તેમજ જોઈન્ટ સ્ટોક કંપનીના શેર તથા બીજી જામીનગીરીના ખરીદ વેચાણના ટ્રાન્સફર પર બેંક વતી સહી કરી શકશે.	બેંકના વ્યવસ્થાપક મંડળ તરફથી જે તે વખતે ઠરાવ કરીને જેમને અધિકાર આપવામાં આવે તે અમલદારો પૈકી ગમે તે બે જણાની સહીથી બેંકના ખાતાઓનો વહીવટ કરી શકશે અને કરજ (Borrowing) તથા બેંકના એન્ડોર્સમેન્ટ કરી શકશે. તેમજ બીજી જામીનગીરીના ખરીદ વેચાણના ટ્રાન્સફર પર બેંક વતી સહી કરી શકશે.
			બેંકના રોકાણો તથા તેના ઉપર કરજ મેળવવા માટે



## -: સભાસદો / ગ્રાહકોએ ધ્યાનમાં રાખવાની જરૂરી વિગતો :-

- આપનું સરનામું, ફોન નંબર, મોબાઇલ નંબર તથા E\_mail ID બદલાયા હોય તો તાત્કાલીક બેંકને જાણ કરશો.
- કોઈપણ પ્રકારના ખાતા માટે ગ્રાહક (વ્યક્તીગત / બીનવ્યક્તીગત) નો ઓળખનો પુરાવો તથા સરનામા નો પુરાવો ભરેલા નીચત ફોર્મ સાથે રીઝર્વ બેંક ઓફ ઈન્ડિયાની KYC/ CKYC ગાર્ડ ડાઈન મુજબ આપવાનો ફરજીયાત છે, તથા પાનકાર્ડ અથવા ફોર્મ ૬૦/૬૧ ઈન્કમેટેક્સ ના કાયદા મુજબ આપવા ફરજીયાત છે. CKYC ગાર્ડ ડાઈન મુજબ PERIODIC KYC (સમયાંતરે પુનઃ KYC) કરાવા નું પણ ફરજીયાત છે.
- દરેક લોકર્સ ખાતેદાર ને જણાવવાનું કે આર.બી.આઈ ની જુના લોકર કરાર નું નવીકરણ તારીખ ૩૧.૧૨.૨૦૨૩ સુધી માં કરાવવું ફરજયાત છે. જો લોકર્સ ખાતેદારે તારીખ ૩૧.૦૩.૨૦૨૩ પહેલા જુના લોકર કરાર નું નવીકરણ કરાવેલ હોય તો તેઓએ લોકર્સ નો પુરક કરાર કરવો પણ ફરજયાત છે. જો લોકર્સ ખાતેદારે તારીખ ૩૧.૧૨.૨૦૨૩ પહેલા જુના લોકર કરારનું નવીકરણ કરાવેલ નહીં હોય તેઓને લોકર કરારનું નવીકરણ ના કરાવે ત્યાં સુધી લોકર ઓપરેટ કરવા કે વારપરવા દેવાશે નહીં.
- પોતાના ખાતા (લોકર્સ) ની ચાવી ઉપર Key Embossing જો કરવાનું બાકી હોય તો જે તે શાખામાં જઈ કરાવી લેવું.
- સહકારી કાયદા અન્વયે દરેક ખાતા તથા લોકર્સ માં વારસદાર ની નિમણુંક કરવી ફરજીયાત છે. જેમણે વારસદારની નિમણુંક ન કરી હોય તે તાત્કાલીક વારસદાર નોંધાવી લેવા.
- જામીન થનાર સભાસદ કરજદારે લીધેલ તમામ નાણા અને વ્યાજની રકમ માટે સંપૂર્ણ જવાબદાર છે, નહિ કે ફાળે પડતી રકમ માટે.
- બેંકના મુદતવીતી કરજદારો / જામીનદારો એ સત્વરે નાણા ભરી / ભરાવી દેવા અન્યથા કાનુની કાર્યવાહી કરવામાં આવશે.
- સભાસદો એ પોતાના શેર સર્ટીફિકેટ બેંકની હેડ ઓફીસ માંથી મેળવી લેવા વિનંતી છે.
- બેંક ના સભાસદો / ગ્રાહકો ની ડિપોઝીટ પરના વ્યાજની આવક માં આવક વેરાના નિયમ મુજબ ટી.ડી.એસ. કપાત કરવામાં આવશે. જો સભાસદે / ગ્રાહકે ટી.ડી.એસ. ની કપાત ના કરાવવી હોય તો પ્રતિ વાર્ષિક ૧૫ જી / ૧૫ એચ ફોર્મ આવક વેરા ની મર્યાદા મુજબ બેંક માં જમા કરાવવા નું રહેશે.
- આપના દરેક ખાતામાં નિયમિત વ્યવહાર કરશો. ૧૦ વર્ષ થી વધુ સમયથી વ્યવહાર કરવામાં નહિ આવે તેવા ખાતાનું બેલેન્સ રિઝર્વ બેંકના નિયમ મુજબ DEAF Fund માં જમા કરવામાં આવશે.
- રીઝર્વ બેંક ઓફ ઈન્ડિયાની સુચના મુજબ ખાતેદારોએ મોબાઇલ નંબર લખાવી દેવો જેથી નાણાની લેવડ દેવડ કરતી વખતે SMS થી જાણકારી મેળવી શકાય, તેમજ E\_mail ID પણ લખાવી દેવા વિનંતી જેથી ખાતા નું સ્ટેટમેન્ટ ઇમેલ થકી મેળવી શકાય.
- આપના ડેબીટ કમ એટીએમ કાર્ડને લગતી માહિતી જેવી કે, કાર્ડ નંબર, એક્ષપાયરી ડેટ, એટીએમ પીન, સીવીવી નંબર, કોઈને પણ જણાવશો નહીં. આ માહિતી કોઈ બેંક એ ઓથોરીટી માંગતી નથી.

આપના દરેક નવીન બેંકીંગ વ્યવહારમાં હવેથી IFSC Code "HDFC0CTBCCB" આપવો, તેમજ સાથે સાથે આપના જુના ચાલતા વ્યવહાર જેવાં કે... મ્યુચ્યુઅલ ફંડ, ઈન્શ્યોરન્સ, એન.બી.એફ.સી. અને અન્ય બેંકો સાથે સંકળાયેલ ACH, NACH તેમજ Mandate માં પણ નવો IFSC Code અપડેટ કરાવવો.

બેંકના જુના IFSC Code "KKBK0BCCB01, KKBK0BCCB02, KKBK0BCCB03, KKBK0BCCB04, KKBK0BCCB05, KKBK0BCCB06, KKBK0BCCB07 તથા KKBK0BCCB08", ટૂંક સમયમાં બંધ કરવામાં આવશે જેની આપ સર્વે નોંધ લેશો.

## . -: અન્ય સુવિધાઓ :-

- ફીક્સ ડીપોઝીટની રકમ ઉપર માસિક / ત્રિમાસિક વ્યાજની સગવડ.
- બેંકમાં મુકેલ થાપણ નું વ્યાજ રૂા. ૪૦,૦૦૦/- સુધી તથા વરીષ્ઠ નાગરીક માટે રૂા. ૫૦,૦૦૦/- ના કરમુક્તી પાત્ર છે.
- રૂા. ૫,૦૦,૦૦૦/- સુધી ની થાપણોને DICGC હેકળ રીઝર્વ બેંક ઓફ ઈન્ડિયા દ્વારા વિમાનું રક્ષણ.
- થાપણો સામે જરૂર પડેથી લોન / ઓવરડ્રાફ્ટની સુવિધા તથા સોનાના દાગીના સામે ત્વરીત ઘિરાણ ઉપલબ્ધ રહેશે.
- સંપૂર્ણ કોમ્પ્યુટરાઈઝ્ડ પદ્ધતિ થી બેંકીંગ અને બેંકીંગને લગતી સઘળી સેવા ઉપલબ્ધ છે.
- બેંકમાં ફ્રેકીંગ (સ્ટેમ્પ) કામગીરી હેડઓફીસ તથા કારેલીબાગ શાખા માં ઉપલબ્ધ છે.
- બેંકમાં Cr/Dr RTGS/ NEFT/ ACH/ UPI તથા Credit LPG (GAS) Subsidy ની સેવા આપવામાં આવે છે. સેવિંગ્સ ખાતાઓમાં Debit Card ની સુવિધા ચાલું કરવામાં આવેલ છે જેનો લાભ લેવા વિનંતી છે. બેંકે IMPS (Fund Transfer) ની સવલત રાખેલ છે જેથી આપ આપના મોબાઇલ માં બેંક ની App Download કરી Fund Transfer તથા BBPS (ભારત બીલ પેમેન્ટ સીસ્ટમ) થકી બીલ પેમેન્ટ કરી શકો છો તો તેનો લાભ લેવા વિનંતી.
- સીનીયર સીટીઝન ને ફીક્સ ડીપોઝીટ પર ૦.૫૦% વધુ વ્યાજ.
- બેંકમાં મહારાણી કન્યા વિદ્યાલય ની સ્કુલ ફી લેવામાં આવે છે.
- બેંકમાં CBS હોવાથી કોઈપણ શાખા માંથી નાણાં ની લેવડ દેવડ કરી શકાય છે.
- UPI આધારીત QR Code થી પોતાના બેંક ખાતા માં રકમ જમા કરાવી શકાશે જે માટે શાખા મેનેજર નો સંપર્ક કરવો.

## આપની સમજદારી એજ આપની સુરક્ષા

જો આપની સાથે ઓનલાઇન નાણાકીય ફ્રોડ કે અન્ય સાયબર ક્રાઇમ થાય તો તુરત જ ૨૪ કલાક કાર્યરત...  
સાયબર ક્રાઇમ ફરીયાદ નંબર: 1930 અથવા ઓનલાઇન પોર્ટલ (NCCRP પોર્ટલ - [www.cybercrime.gov.in](http://www.cybercrime.gov.in)) પર ફરીયાદ કરો.  
ત્યારબાદ તે ફરીયાદ નોંધણી નંબર સહીત  
બેંકના મોબાઇલ નંબર ૯૭૧૪૦૦૦૮૭૬ અથવા બેંકની નજીકની શાખાનો કામકાજના સમય દરમિયાન સંપર્ક કરવો.

# ધી બરોડા સીટી કો-ઓપરેટીવ બેંક લી.

## વડોદરા

### નોટીસ

આથી આ બેંકના તમામ સભાસદોને જણાવવામાં આવે છે કે આ બેંકની ૯૭ (સત્તાણું)મી વાર્ષિક સાધારણ સભા તા. ૨૪.૦૬.૨૦૨૪ ને સોમવારના રોજ બપોરે ૪-૦૦ વાગે “સરદાર પટેલ વાડી”, સંસ્થા-વસાહત, રાવપુરા, વડોદરા ખાતે નીચેના કામો કરવા સારૂ મળશે તો તેમાં હાજર રહેવા વિનંતી કરવામાં આવે છે.

૧. સાધારણ સભાના પ્રમુખશ્રીની નિમણુંક કરવા બાબત.
૨. ગઈ સાધારણ સભાનો અહેવાલ વંચાણમાં લેવા બાબત.
૩. તા.૩૧.૦૩.૨૦૨૪ના રોજ પુરા થતા વર્ષના કામકાજનો અહેવાલ સરવૈયું તથા નફાતોટાનો ઓડીટરે તપાસેલ હિસાબ મંજૂર કરવા તથા ઓડીટ રીપોર્ટ વંચાણમાં લેવા બાબત.
૪. નફાની વહેંચણી મંજૂર કરવા બાબત.
૫. સને ૨૦૨૪-૨૦૨૫ના વર્ષ માટેનું ખર્ચનું અંદાજ પત્રક મંજૂર કરવા બાબત.
૬. પેટા નિયમના સુધારા વધારા મંજૂર કરવા બાબત.
૭. સને ૨૦૨૪-૨૫ના વર્ષ માટે ઓડીટરશ્રીની નિમણુંક કરવા બાબત.
૮. બેંકના એન.પી.એ. ધિરાણ ખાતાઓના નિકાલની નોંધ લેવા તથા એન.પી.એ. ધિરાણો પૈકી ઘણા વર્ષોથી બીન ઉપજાઉ રહેલ લેણું માંડવાળ કરવા બાબત.
૯. મે.રા.રા. પ્રમુખ સાહેબની પરવાનગીથી રજુ થાય તે કામનો નિકાલ કરવા બાબત.

સંસ્થા વસાહત,  
રાવપુરા, વડોદરા.  
તારીખ: ૦૭-૦૬-૨૦૨૪

વ્યવસ્થાપક મંડળના હુકમથી  
સત્યેન એસ. પટેલ  
સી.ઈ.ઓ.

તા.ક:-

- ૧ કોરમ ન થતા મુલતવી રહેલી સભા એક કલાક બાદ કોરમનો બાધ લીધા સિવાય મળશે. તેમા સભાનું કામકાજ કરવામાં આવશે.
૨. વાર્ષિક સાધારણ સભાના કાર્યક્રમમાં દાખલ ન હોય એવા વિષયની બેંકને લગતી કોઈ માહિતી અગર ખુલાસા જોઈતા હોય તો તે અંગેની લેખિત જાણ સભાના ચાર દિવસ અગાઉ પહોંચે તે રીતે બેંકની હેડ ઓફીસમાં મોકલી આપવા વિનંતી છે.

BOOK-POST  
PRINTED MATTER

મતિ શ્રી, \_\_\_\_\_  
\_\_\_\_\_  
\_\_\_\_\_  
\_\_\_\_\_

રવાના :

ધી બરોડા સીટી કો.ઓપરેટીવ બેંક લી.  
હેડ ઓફીસ : સંસ્થા વસાહત, રાવપુરા,  
વડોદરા – ૩૯૦ ૦૦૧.